

શ્રી સોરથ વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈનું મુખ્યપત્ર

# સોરથ વિશાશ્રીમાળી


પૃષ્ઠ : ૪૪

વર્ષ : ૪૯

મુલ્ય : રૂ. ૮/-

અંક : ૯

સપ્ટેમ્બર ૨૦૨૧



## મિચ્છામી દુક્કડમ્ભ ।

વિઘહતો ગણોશાળ

આ સૂચિ પરથી વિદાય લેતાં

એ આર્થીવાદ આપતાં જાવ કે અમારા સહુની કોરોનાથી મુક્તિ કરો

## સપ્ટેમ્બર માસના મુખ્યપત્રનાં સૌજન્ય દાતા



### શ્રીમતી મંજુલાબેન મહિલાલ નાથાલાલ શેઠ

મંજુલાબેન સ્વભાવે શાંત, કુટુંબ-પરિવાર પ્રત્યે સ્નેહની ગંગા વહેવડાવનાર તેમ જ લાગણીશીલ સ્વભાવનાં સાચા અર્થમાં સનિષ્ઠ નારી છે. તેમનાં સદ્ગુણો, લાગકી, ઉદારતા અને પ્રેમ જેવા ઉચ્ચ સંસ્કારો તેમના પુત્રો-પુત્રવધૂ અને દીકરીઓમાં જોવા મળે છે. તેમના જીવનમાં જીવદ્યા, કરુણા અને સ્થાન ધરાવે છે તેમ જ ધર્મ પ્રત્યે સાચો અભિગમ ધરાવે છે. બીજાનું કામ નિઃસ્વાર્થ ભાવે કરી આપવાની મનોવૃત્તિ ધરાવે છે.

તેઓ મૂળ પાટકાવાળા શેઠ શ્રી જવેરચંદ્રભાઈ વસાનાં સુપુત્રી. તેમના સુપુત્રો (૧) પરેશભાઈ (૨) ચેતનભાઈ (૩) રોહિતભાઈ તેમ જ પુત્રવધૂઓ (૧) નીતાબેન (૨) હીનાબેન (૩) હેતલબેન તેમ જ પૌત્ર અને પૌત્રીઓ જિનલ, ધર્મિન, યશ, મિત, નિશિથ, જૈનમ, સમગ્ર પરિવારની અંદર દરેક જતન કરીને સંસ્કારોનું સિંચન કરી રહ્યાં છે. તેમના પુત્રો અને પુત્રવધૂઓ માતા મંજુલાબેનના ફદ્યની છથ્થા અને કરુણાનાં અનેક કાર્યો કરી રહ્યાં છે.

આદર્શ ગૃહિણી, પ્રેમાળ માતા અને પરિવારનાં મોભી તરીકે સૌ પ્રત્યે સ્નેહ અને પ્રેમ વરસાવી રહ્યાં છે તેમ જ શિક્ષણ પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે.

તેમના તથા તેમના પરિવારના આ પ્રકારના અભિગમની લાગણીથી સમાજ ગોરવ અનુભવે છે.

તેમના પરિવારને સમાજના ખૂબ ધ્યાવાદ.

## શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ

શ્રી તારાયંદ ધનજ્ઞભાઈ મહેતા કાર્યાલય,  
૪, દેવકરણ મેન્ચન, બિલ્ડિંગ નં. ૭, બીજે માળે, ૨૪, વિહુલાસ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨

For Website Registration Mobile No. 9321775805

ફોન : ૦૨૨-૨૨૦૬૫૧૭૨

સમય : બપોરે ૧-૦૦થી સાંજે ૬-૦૦ (1.00 pm to 6.00 pm)  
Email : svjainsamajmumbai2@gmail.com-data@svjainsamaj.com  
www.svjainsamaj.com

તંત્રી : શ્રીમતી કીર્તિબેન મહુરભાઈ મહેતા મો. ૯૨૨૪૭૭૧૨૩૮

### સમાજની કાર્યવાહીક કારોબારી સમિતિ

શ્રી મહેશભાઈ મથુરાદાસ સાવડીયા ----- પ્રમુખ  
શ્રી ગુણવંતભાઈ વૃજલાલ મહેતા ----- ઉપ-પ્રમુખ  
શ્રી મહુરભાઈ નગીનદાસ મહેતા ----- માનદમંત્રી  
શ્રી દીક્ષિતભાઈ નટવરલાલ માજની ----- માનદ સહમંત્રી

### સલાહકાર સમિતિ

શ્રી શ્રીકાંતભાઈ સાકરયંદ વસા - શ્રી પ્રવીણભાઈ હિંમતલાલ સંધ્વી  
શ્રી મહેન્દ્રભાઈ ઓતમયંદ પુનાતર - શ્રી પરેશભાઈ મહોલાલ શેઠ

#### BANK DETAILS:

Name : SHRI SORATH VISA SHRIMALI JAIN SAMAJ

BANKER : Bank of Baroda, M. J. Market, Mumbai-3

S. B. A/c No. 03870100000044

IFSC : BARB0BULLIO MICR : 40012047

Name : SORATH VISA SHRIMALI JAIN SAMAJ TRUST

BANKER: UNION BANK OF INDIA

Princess Street, Mumbai - 400 002

S.B.A/c. No. 319102010054364

IFSC : UBIN0531910

કાનૂની કાર્યક્ષેત્ર મુંબઈનું રહેશે

**Auditor : Viren Vasa & Associates  
Chartered Accountants, Mumbai**

લવાજમના દરો

ભારતમાં

વાર્ષિક :

રૂ. ૧૦૦/-

આજીવન રૂ. ૧૫૦૦/-

પરદેશમાં (ફક્ત વાર્ષિક) : USD 20 Yearly

મુદ્દા અને પોસ્ટિંગ અરિંગ્ટન પ્રિન્ટિંગ પ્રેસ-નીતિનભાઈ બદાણી

સાઈબાબા નગર, ૩૧૦ નિકાલ બિલ્ડિંગની પાછળ,

નાયડુ કોલોની પાસે, પંતનગર, ઘાટકોપર (૬), મુંબઈ-૭૫

ફોન: ૯૨૨૪૭૩૦૪૧૫



## શ્રી સોરઠ વિશાશ્રીમાળી

અંક - ૫૮ ર્ધ : ૪૫ ૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ૦ મૂલ્ય રૂ. ૮

### ગીત

ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને

કદિ ધીરેથી પૂછે કે કેમ છે,

આપણો તો કહીએ કે દરિયા - શ્રી મોજમાં ને

ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા બિસ્સાની આડમાં મૂકી છે અમે

ઇલકાતી મલકાતી મોજ,

એકલો ઊભું ને તોય મેળામાં હોઉ એવું

લાગ્યા કરે છે મને રોજ.

તાણું વસાય નહીં એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે,

આપણો તો કહીએ કે દરિયા - શ્રી મોજમાં ને

ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય

નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટની કાંઠાઓ રાખે હિસાબ

નથી પરવા સમંદરને હોતી

સૂરજ તો ઊગે ને આથમીયે જાય

મારી ઉપર આકાશ એમનેમ છે,

આપણો તો કહીએ કે દરિયા - શ્રી મોજમાં ને

ઉપરથી કુદરતની રહેમ છે.

- ધૂંવ ભણ

## હાઇક શ્રદ્ધાંજલી



### સ્વ. પ્રકુલચંદ્ર નરભેરામ મહેતા

મૂળ વતન: મધ્યરવાડા

દ્વારા: કાંઈવલી

જન્મ: તા. ૨૭-૧૦-૧૯૪૭

સ્વર્ગવાસ: તા. ૦૬-૦૬-૨૦૧૭

આપનો મિલનસાર સ્વભાવ, નિર્મણ કદમ્બ, ધર્મગ્રદ્ધી, વિવેકશક્તિ અને હેઠે કુદુર્ભીજનોને ઉપયોગી ધ્વાની સદ્ભાવના નિર્દેશ રહેશે. આપનું આદરભૂત જીવન અમોને હુંમેશા ગેરણા આપતું રહેશે. ગ્રેમ, સ્નેહ અને સંસ્કાર વડે આપે અમારા જીવનનું ઘડતર કર્યું અને આપના આશીર્વાદથી અમો આ મુકામ પર ઉલ્લા રહી રહ્યા છીએ. આપનાં અનંતો ઉપકાર કઢી ભૂલી રહીયું નથિ. આપની અમી દ્રષ્ટી અમારા પર વરસતી રહે.

રહેવાને કોઈ સદાય આવતું નથી, છતા તમે ગયા તેમ કોઈ જતું નથી,  
વિદાય એવી લીધી કે મન દર્જ માનતું નથી, નિર્દોષ દુસ્તું મુખ્યતું નજર સામેથી જતું નથી,  
જીવન એવું જીવી ગયા કે જીવનારા જોયા કરે, કર્મ એવા કર્યા કે હદ્યમાં સૌના ગુંજતા રહે.

હુ પરમ કૃપાળુ પરમાત્મા, સદગત આત્માને શાશ્વત સુખ અને પરમ શાંતિ અપો  
એવી અમારા સહ પરિવારની પ્રાર્થના.

લી: સ્વ. નરભેરામ સવજી મહેતા પરિવાર

પત્રી : સુદર્શનાબેન પ્રકુલાભાઈ મહેતા      બાહુન-બનેવી : સરલાબેન - રસિકલાલ કુલચંદ ગાંધી

પુત્ર-પુત્રવધુ : મેહુલ - સોનાલી તથા સ્નેહુલ - શુક્રિ

પુત્રી : સેજલ

પૌત્ર : કાલ્ય, નીવ

ભાણેજ : કવિતા, નીરેન, રાજુલ, જ્ય

મોટી પાનેલી નિવાસી શ્રી ગોકળભાપાના જમાઈ

સી-૪૦૨, કુળનિધિ, હેમુ કાલાની કોસ રોડ નં. ૨, ઇરાનીવાડી નં. ૨,  
કાંઈવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૭. ફોન: ધર: ૦૨૨-૬૫૨૮૮૮૮૨૭



# તંત્રીસ્થાનેથી

મારા વાચક મિત્રો,  
સહુને મારા સાદર મણામ,

મારા બધા વાચક મિત્રોને મારા અંતઃકરણપૂર્વક મિશ્યામી દુક્કડમ્ભ. હવે તો તહેવારોની મોજ લાગી જશે. જોતજોતામાં નવરાત્રિ, દરોરા, દિવાળી ક્યારે આવી જશે એ ખબર પણ નહીં પડે. પર્વ પર્યુષણાના આઠ દિવસ કેવા જલ્દી પસાર થઈ ગયા અને જોતજોતામાં તો ચોમાસું પણ પુરુ થઈ જશે. બધા જ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના. જેમણે તપસ્યા કરી હતી તેમણે તો આહાર ઉપર પોતાનો સંયમ રાખીને પોતાના મનોબળથી તપ કર્યું. હવે એવું જ તપ આપણો સૌઓ અમને ન વેડફ્વાનું કરવાનું છે.


સમજું અને શાણા માણસો ખાણું જેવું પોતાની પાસે આવે ત્યારે તેના પર તરાપ નથી મારતાં. પોતાની રૂચિ અને પાચન શક્તિનો ખ્યાલ કરે છે, પછી જ ખોરાક લેવાનું રાખે છે. એટલે કે જેટલું પચે તેમ હોય તેટલું જ વાપરે છે. આજના લુસ-લુસ જમાનામાં એ વાત આપણે સંદતર ભૂલી ગયા છીએ કે ગલીએ ગલીએ ખાવાનું વેચતી હોટેલ, હાટડી કે રેકડી જોવા મળે છે, પણ સવાલ એ છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ? ઊપનિષદમાં અમને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. જ્યારે અમને આપણે બ્રહ્મ સ્વરૂપમાં ગણતા હોઈએ તો ત્યારે અમ શાંતિથી બેસીને વાપરવું જોઈએ અને એનો વ્યય ન કરવો જોઈએ. ખરેખર આ રીતે આપણે અન્ન વાપરીએ છીએ ખરા? આપણાને ખ્યાલ નથી આવતો કે ધરતીની માટી, વરસાદ, ખેડૂતની મહેનત જોતરાય ત્યારે અનાજ ઊગતું હોય છે. કેટલીય મહેનત પછી એ અનાજ ધાન્યના રૂપમાં આપણાને બજારમાં મળે છે અને એની પછી કેટલાક કલાકોની મહેનત પછી ધરની ગૃહિણી રસોઈ બનાવીને ટેબલ પર મુકે છે. આ વાત કદાચ નાની લાગે પણ જરાય નાની નથી.

અમનો એક દાણો ઊગે અને એ પેટમાં જાય ત્યારે એનું ઊગવું સાર્થક થતું હોય છે. બુફેમાં ફરીવાર કાઉન્ટર પર ન જવું પડે એ માટે બુફે ડિશમાં ભરીભરીને લેવું અને છેલ્લે ઘણુભધુ અમ છોડી દેનારા અપરાધી છે. એક તરફ, લાખો લોકોને એક ટંકનું ખાવાનું નસીબ નથી હોતું. જ્યારે જેમને સહેલાઈથી મળે છે એમને ગણ નથી હોતો. ખરેખર તો જમતી વખતે એ ખેડૂતને વંદન કરવા જોઈએ જેણો પોતાની જાત જોતરીને અનાજ ઊગાડ્યું છે, એ માટીને વંદન કરવા જોઈએ જેનાથી અમના ઊર્જા પ્રવેશી છે. એ વરસાદને વંદન કરવા જોઈએ જેનાથી અનાજ ઊગ્યું છે, મહિનાઓની પ્રક્રિયા પછી લોજન આપણી થાળીમાં આવતું હોય છે છતાં આપણે એને અધકચરો ન્યાય આપીએ છીએ.

મમ્મીએ કે પત્નીએ લોઢી પર તૈયાર કરેલી રોટલી થાળીમાં આવે ત્યારે ટીવી જોતાં કે વાતોનાં વડા કરતાં કરતાં પેટમાં પદ્ધરાવીએ છીએ. દેશ હોય કે પરદેશ આવી ચેદ્ધા રોગિષ માનસ દર્શાવે છે. પૂજ્ય ડાંગરે મહારાજે એક કથામાં કહ્યું હતું કે, ‘અમ ફેંકનાર બીજા જન્મમાં ભિખારી બને છે.’ અમનો એક કોળિયો એ જ તો સ્વર્ગ છે. જેમ આકાશમાં તારા એકબીજાની સાથે મળીને પ્રકાશ આપે છે તેમ અમના પણ એજ નિયમ છે કે સૌની મહેનત, પરિશ્રમથી જ અમ ઉત્પત્ત થાય છે. ખૂબ મહેનતથી ગૃહિણીઓ રસોઈ તૈયાર કરે છે તો એ અમ ગ્રહણ કરતી વખતે મન પ્રફુલ્લિત રાખવું, બનાવનારને માન આપવું અને અન્નનો અનાદર ન કરવો અને ન વેડફ્વાનું એવો નિયમ આપણો સૌ સાથે મળીને લઈએ. એવી જ મારી અભિલાષા.

K. M. Mehta

## શ્રદ્ધાંજલી



: જન્મ :  
તા. ૨૮-૧૦-૧૯૩૬

: સ્વર્ગવાસ :  
તા. ૧૦-૦૮-૨૦૦૧

### સ્વ. શ્રી નવીનચંદ ઈશ્વરલાલ શેઠ જૂનાગઢ નિવાસી - હાત (સાયન)

તમે આવ્યા અમારા જીવનમાં, ફૂલલાંડી બનીને,  
ધૂપરાળી બની સર્વત્ર મહેંકી ઊઈયા, યાદ તમારી આવતા આંખલડી છલકાય છે,  
જોઈ તસવીર તમારી, આંસુ ઊભરાય છે, આપનો મિલનસાર અને પરોપકારી સ્વભાવ,  
ઉદારતા, કાર્યકુશળતા, કુટુંબપ્રેમ સદા અમારા હૃદચમાં રહેશે.  
સમગ્ર પરિવાર પર આપના આશીર્વાદ કાયમ રહે એજ અભ્યર્થના.

માતુશ્રી : સ્વ. મંગળાબેન ઈશ્વરલાલ શેઠ • પિતાશ્રી : સ્વ. ઈશ્વરલાલ હરભયંદ શેઠ

પત્ની : શ્રીમતી ઉષાબેન નવીનચંદ શેઠ (મુંબઈ)

પુત્ર : તેજસ નવીનચંદ શેઠ • પુત્રવધૂ : શીતલ તેજસ શેઠ • પૌત્ર : દર્શ તેજસ શેઠ

પુત્રી-જ્માઈ : શીત્યા - મિલીન્દ, શીતલ - ગૌતમ • દોહીત્રી : નિયોતી, અપાર, નિરાલી, નિધિ, કુંજલ

ભાઈ-ભાભી : વસંત - સાધના, ધીરેન - નીતા, યતિન્દ્ર - નીતુ, શૈલેષ - જ્યોતિ, સ્વ. પિયુષ

બહેન-બનેવી : ભાનુમતી ગુણવંતલાલ, હંસા જગદીશભાઈ તેમ જ

સર્વે કુટુંબીજનો તથા મિત્રમંડળની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

નિવાસસ્થાન : શ્રી નવીનચંદ ઈશ્વરલાલ શેઠ, ૨૭૨ / ૨૭૩, લિંદ રાજસ્થાન શોપિંગ સેન્ટર,  
૧લે માળે, બલોક નં. ૧, સાયન હોસ્પિટલની બાજુમાં, સાયન (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૨૨

ફોન : ૨૪૦૭૫૦૪૩, મો.: ૯૮૧૯૪૮૮૮૮૦ / ૯૮૨૧૩૪૮૯૭૭

શ્રી ઈશ્વરલાલ હરભયંદ શેઠ પરિવાર

## ભેદજ્ઞાનની ઉત્કૃષ્ટ સાધના છે કેશલુંચન

જૈન ધર્મની સામાન્ય પ્રથા છે જે દીક્ષા લીધા પછી સાધુ અને સાધીજી વર્ષમાં એક યા બે વાર પોતાના વાળને જાતે હાથેથી ખેંચીને કાઢે છે. આ પ્રથાના માધ્યમથી જૈન સાધુ આ દુનિયાથી જોડાયેલાં બધાં જ સુખોનો પરિત્યાગ કરે છે.

સૂયગડાંગ સૂત્રની ચૂર્ણિમાં ચૂર્ણિકારે “કેશ” શબ્દની વ્યુત્પત્તિનો અર્થ કરતાં જણાયું છે કે, અર્થાત્ વાળને ખેંચવાથી મનુષ્યને કલેશ થાય છે, માટે વાળને કેશ કહેવાય છે. કેશ ખેંચવાની પરંપરા પ્રાર્ચીનકાળથી રહી છે.

“કેશલુંચન” ‘કાયકલેશ’ નામના પાંચમા બાબ્ય તપમાં ગણાય છે. લુંચન એટલે વાળને ચેપટીથી પકડીને ઝટકા સાથે ઉખાડવાની કિયા. લુંચન અનેક કારણો થાય છે. દેહવિભૂષાથી બચવા; દેહસક્તિમાં ચૂનતા માટે; જૂ, લીંખ આદિની ઉત્પત્તિના નિવારણાર્થ; પ્રભુઆજ્ઞાના પાલન માટે; પોતાની આત્મશક્તિ પ્રગટ કરવા માટે, દિગંબર માન્યતાનુસાર સાધુના ૨૮ મૂળગુણમાં ‘કેશલુંચન’ એક ગુણ ગણવામાં આવે છે.

જૈન ધર્મમાં શ્રીમણો માટે ‘કેશલુંચન’ એક આદરણીય અને અવશ્યકરણીય આચારના રૂપમાં માનવામાં આવે છે. કેશલુંચનની કિયા બાવીસ પરિષહમાં ગણવામાં નથી આવતી.

યુદ્ધમાં વિજયપ્રાપ્તિ હેતુથી કોઈ સૈનિક મહાયોજ્ઞ હસતાહસતા દરેક પ્રકારનાં કષ્ટ સહન કરી લે છે. ત્યારે તેને કોઈ એમ નથી કહેતું કે તે પોતાને ખૂબ દુઃખ આપે છે. બધા તેને અભિનંદન આપે છે. તેવી જ રીતે જૈન શ્રીમણો (સાધુઓ)ની ચર્ચા પણ પરમયોજ્ઞાની છે. અહીંથી મોહ આદિ પ્રબળ આત્મશત્રુઓ સાથે આચા મહાસંગ્રામ ખેલે છે. મુંડનપરંપરા અનેક સાધનામાર્ગોમાં જોવા મળે છે, પરંતુ કેશલુંચનના માધ્યમથી મુંડન વિશ્વમાં એકમાત્ર જૈન શ્રીમણાપરંપરામાં જ જોવા મળે છે. કેશલુંચન મુંડનની સાધના સર્વोત્કૃષ્ટ રૂપ છે.

મુંડન અપનયનનું સુંડાંગ: મુંડ એટલે દૂર કરવું. તેના બે ભેદ છે. દ્રવ્યથી અને ભાવથી દ્રવ્યમુંડન - મસ્તક પરના વાળને દૂર કરવા, શિરો મુંડન તે દ્રવ્ય મુંડન છે, ભાવ મુંડન ઈન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિને દૂર કરવી, તેમાં રાગ-દ્રોગ તથા કોધાદિ કષાયને દૂર કરવા, કષાય વિજયને ભાવ મુંડન કરે છે. સ્થાનાંગ સૂત્રના દરશમા સ્થાનમાં દસ પ્રકારનાં મુંડનનું વર્ણન છે. તેમાંથી પાંચ ઈન્દ્રિય અને ચાર કષાય આ નવ પ્રકારનાં મુંડન તે

ભાવ મુંડન અને અંતિમ શિર (મસ્તક) મુંડન દ્રવ્ય મુંડન છે.

ભગવાન મહાવીરે ૧૦ પ્રકારનાં મુંડન બતાવ્યાં છે. પાંચ ઈન્દ્રિયોનું મુંડન, ચાર કષાયનું મુંડન અને દશમું માથાનું મુંડન.

મુંડન અર્થાત્ પોતાની ઈન્દ્રિય, મન અને શરીર પર વિજય પ્રાપ્ત કરી આત્મામાં સ્થિર થવું. જેવી રીતે ઇન્દ્ર સુખનો અનુભવ કરે છે તેવી જ રીતે મનુષ્યને શારીરિક સુખોનો અનુભવ કરવા માટે પ્રકૃતિએ પાંચ ઈન્દ્રિયો આપી છે.

કાનથી સાંભળવું, આંખથી જોવું, નાકથી સૂંઘરું, જીબથી ભોજન કરવું અને સ્પર્શથી અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શનો અનુભવ કરવો. આ પાંચ ઈન્દ્રિયોના અનુકૂળ વિષય મળવા પર વ્યક્તિને સુખનો અનુભવ થાય છે. પ્રતિકૂળ થવા પર દુઃખનો અનુભવ થાય છે. અગર બન્નોયાં વ્યક્તિ સમભાવમાં રહે છે તો એ પાંચ ઈન્દ્રિયોનું મુંડન કરી લે છે. આજ રીતે કોધ, માન, માયા, લોભમાં જો સમભાવ રાખે, જરૂરિયાતો પૂરી ન થવા પર પણ શાંત રહે છે, અપમાન મળવા છતાં પણ સ્વાભાવિક સ્થિતિમાંથી બહાર નથી જતા, કોઈ કપટીના છેતરાઈ જવા પર પણ એની સાથે સમભાવમાં રહેવું, બહુ લાભ થાય યા નુકસાન થાય તો પણ સમભાવમાં રહે છે તો એણો ચાર કષાયનું મુંડન કર્યું કહેવાય.

છેલ્લું મુંડન છે માથાનું મુંડન.

ભગવાને પૂછવામાં આવ્યું કે જે લોચની પરંપરા છે એનો કોઈ આધ્યાત્મિક સંબંધ છે યા ખાલી પરંપરા છે ???. ભગવાને કીધું કે લોચનો સંબંધ આધ્યાત્મિક સાથે છે. શરીર અલગ છે, આત્મા અલગ છે આ ભેદજ્ઞાનની અનુભૂતિ સાથે જે લોચ કરે છે યા કરાવે છે એને મોટાં કર્માની નિર્જરા થાય છે અને જે પરંપરા માનીને લાચારીથી લોચ કરે છે યા કરાવે છે એને મોટાં પુણ્યનું ઉપાર્જન થાય છે. અતઃ મન અને શરીરથી પાર જવાની સાધના છે કેશલુંચન. ભેદજ્ઞાનની સાથે જે લોચ કરે છે એ અનંત કર્માનો ક્ષય કરે છે. લોચ ભેદજ્ઞાનનો અનુભવ એવમ આત્મસાત્તની સાધના છે. ભેદજ્ઞાનની ઉત્કૃષ્ટ સાધના છે - કેશલુંચન.

સંવત્સરી પ્રતિકમણ પૂર્વ સાધુ-સાધીજીનું કેશલુંચન થવું આવશ્યક હોય છે.

- ૫. પૂ. પારસમુનિ

## પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલી



### સ્વ. શ્રી પ્રેમચંદ્બાઈ મુલચંદ્બાઈ શોઠ

બાંટવા (સોરઠ) સ્વર્ગવાસ : સંવત ૨૦૧૩ ભાద્રવા સુદ - ૧૧

“અમારા ઉજજવળ ભવિષ્યના તમે પાયા બન્યા  
પ્રેરણા અને પ્રોત્સાહનના આપ સુકાની બન્યા,  
તમારી દીર્ઘદૃષ્ટિ અને પૂર્તિની ધગશ બને છે  
અમારા માર્ગદર્શન અને સંરક્ષક !”

ધર્મપત્ની - સ્વ. કુસુંબાબેન પ્રેમચંદ્બાઈ શોઠ

પુત્ર - પૂત્રવધૂ : મનુભાઈ - મધુબહેન, ભીખુભાઈ - રંજનબેન

પુત્રી - જમાઈ : લાભકુંવરબહેન - મગનલાલ શોઠ, ધીરજબહેન - લલલુભાઈ વસા

ચંદ્રિકાબહેન - હિંમતલાલ ધૂવ

પૌત્ર - પૌત્રવધૂ : મિલનભાઈ - સ્વાતિબહેન, નિલેશભાઈ - અલ્પાબહેન, મયુરભાઈ - પલ્લવીબહેન

પૌત્રી - જમાઈ : જલ્પાબહેન - તિથૈશભાઈ શાહ, અલ્કાબહેન - સુજણકુમાર શાહ,

આરતીબહેન - અજ્યભાઈ દોશી પ્રપૌત્ર : જલજ, શીવા, પ્રચિત

### મનુભાઈ પ્રેમચંદ શોઠ

13/1506 ધ એડ્રસ, બી/૪

અલ.બી.એસ. માર્ગ, આર. સીટી મોલ સામે,  
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૮૬.

ફોન : ધર : ૦૨૨ ૨૫૧૭૦૧૭૦ મો.: ૯૮૧૯૯૮૮૫૭૩

## નવલા વર્ષની પહેલી અંધારી રાત...

‘ધુમક્કડી!’ શું છે આ ધુમક્કડી? થોડા શબ્દોમાં કહું તો ધુમક્કડી એટલે અલગારી રખડપડી, રઝપાટ! કોઈ પણ વધુ ખાન વિના, સમયને મુહીમાં બાંધા વગર નીકળી પડવું! જે કોઈ વાહન મળે, જ્યાં રહેવા મળે અને જે કંઈ પણ ખાવા મળે, તેમાં સંતોષ માની, ઓછામાં ઓછી સગવડે અને ઓછામાં ઓછા આર્થિક ખર્ચ ફરવું. એના માટેનો આધુનિક શબ્દ છે ‘ધુમક્કડી. આ હિન્દી શબ્દ છે. ધુમક્કડીમાં અનિશ્ચિતતાની સાથે અનેરો રોમાંચ પણ જોડાયેલો છે. પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસવીરોને ધુમક્કડી આહુવાન કરે છે. ધુમક્કડીનો શોખ આજે વિશ્વભરમાં જોર પકડી રહ્યો છે. આપણા મહાન ધુમક્કડ રાહુલ સાંકૃત્યાયનથી લઈને આજના નીડર, સાહસી, મહિલા વિશ્વપ્રવાસી પ્રીતિ સેનગુપ્તા જેવાં લોકોએ ધુમક્કડીને નવા આયામો આચ્યા છે.

આવી જ એક ધુમક્કડીમાં કૂદી પડવાનો મેં પણ નિર્ણય કર્યો. ધુમક્કડી માટે સ્થાનો પસંદ કર્યા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. સમય નક્કી કર્યો પૂરું એક વર્ષ!

મારી યાત્રાની શરૂઆત આમ તો ૨૮ મે ૨૦૧૮થી શરૂ થઈ. ગ્રાન્ડ તબક્કામાં વહેંચાયેલી આ યાત્રાનો બીજો તબક્કો જેન કલ્યાણાક ભૂમિ, અન્ય જેન તીર્થ, ભગવાન બુદ્ધની ભૂમિ અને વચ્ચે આવતા પર્યટક સ્થળો હતાં. સમેતશિખર સુધી આવ્યા બાદ કલકત્તાની મુલાકાતે જવાનું કઈ રીતે ટાળી શકું? અને આ ઉત્કઠાને સંતોષવા હું પહોંચી પશ્ચિમ બંગાળ! પશ્ચિમ બંગાળ અંતર્ગત આવતા અન્ય તીર્થ સ્થળો કે જ્યાં દૂર કે યાત્રામાં કે બીજી રીતે આવવું ખૂબ મુશ્કેલ હોવાથી પશ્ચિમ ભારતના જેન યાત્રિકો અહીં સુધી નથી પહોંચતા. અરે! મારું પણ ક્યાં નક્કી હતું કે હું પશ્ચિમ બંગાળ સુધી પહોંચીશ! કલકત્તા આવ્યા બાદ બીજા સ્થળોએ જવાનું નક્કી થયું. તો અહીં હું મારા પશ્ચિમ બંગાળના અવનવા શહેરો અને જેન તીર્થોની વાત કરીશ.

પારસનાથ રેલ્વે સ્ટેશન ટ્રેન આવતા ઘમઘમી ઉઠ્યું. થોડીક મિનિટોમાં પાછું શાંત. લાઉડ સ્પીકર કોઈ સ્રી અથવા પુરુષના મીઠા રણકારથી ગુંજ ઉઠતું અને ફરી એ પણ શાંત થઈ જતું. નાનકડા સ્ટેશનનું પ્રતિક્ષાલય ન જાણો કોની પ્રતિક્ષામાં બેહું હતું? કદાચ મારા જેવા

કોઈ એકલ-દોકલ મુસાફરની ઈસુના નવા વર્ષની સવાર સમેતશિખર જૈન કલ્યાણાક ભૂમિ પર સરસ વીતી અને હવે બીજી સવાર પશ્ચિમ બંગાળના મહાનગર કલકત્તામાં થવાની હતી. સમય બચાવવા આગલા દિવસે દેહરાદૂન હાવડા ટ્રેનની ટિકિટ તત્કાલમાં આરક્ષિત કરી લીધી હતી જે મને વહેલી સવારે ૭:૩૦ કલાકે મારા ગંતવ્ય સ્થળે પહોંચાડવાની હતી.

મોડી રાત્રે મધુવનથી પારસનાથ જતા જંગલના રસ્તેથી કોઈ વાહન આવવા તૈયાર ન થાય એટલે મારે ત્યાંથી વહેલા નીકળવું પડ્યું. થોડો સમય પારસનાથ રેલ્વે સ્ટેશનની બહાર ખાવાપીવામાં વિતાવ્યો. ટ્રેનનો સમય રાત્રે ૧૧:૩૦નો હતો. સામાનની ગ્રાન્ડ બેંસ સાથે બીજે કયાંય જવાય તેવું કયાં હતું? શિયાળાની સાંજ વહેલી અંધારામાં પરિવર્તિત થઈ રહી હતી. આખરે વહેલા સ્ટેશને પહોંચી પ્રતિક્ષાલયમાં બેસવા સિવાય કોઈ ઉપાય નહોતો. હું સાત વાગ્યે સ્ટેશને પહોંચી ગઈ. પ્રતિક્ષાલય મુસાફરોથી ઉભરાતું હતું. જ્યારે પ્લેટફોર્મ પર જવલે જ કોઈ મુસાફરો દેખાતાં હતાં. કારણ હતું વધતી જતી હંડી. અંદર જઈને બેસવા માટે જગ્યા શોધી. જાતજાતના અને ભાતભાતના મુસાફરો! બધાને પ્રતિક્ષા હતી પોતાના ગંતવ્યે લઈ જતી રેલગાડીની. પ્રતિક્ષાલયની ભીતો સુંદર મધુબની ચિત્રકારીથી ચિત્રિત હતી.

વારંવાર વાગાતું ભૂંગણું પ્રવાસીઓને સાવધ કરી દેતું. મુસાફરો સંદેશાઓને અનુસરી ખુશી સાથે ઉભા થતાં ને આગળ વધી જતાં. પ્રતિક્ષાનો અંત આવવાની ખુશીમાં મુસાફરો હળબળાહટમાં કક્ષને ખાલી કરી જતાં. એમની જગ્યા ફરી નવા આવનાર મુસાફરોથી ભરાઈ જતી. ફેરીયા, કૂલી અને ભૂંગણાના અવાજથી સ્ટેશન જાણો કેટલીક ક્ષણો માટે કોઈ બજારમાં બદલાઈ જતું હતું. ગરમ થયેલો માહોલ ફરી થોડી મિનિટોમાં કડકડતી હંડી રાતોમાં હુંઠવાઈ જતો. શરીર અને મન બંને જેકેટ-મફલર-ટોપીમાં જકડાઈને ચુપકીમાં સરી જતાં. ઉતાવળા મુસાફરો વારંવાર ગાડીનો સમય જોવા આગળ પાછળ થતા હતા. ટ્રેન સમયથી જાણો વહેલી આવી જવાની ન હોય! તેમ પ્લેટફોર્મ નીચે લાંબી પહૂંરીઓની બન્ને બાજુ વારંવાર જોઈ લેતા. કેટલાક મુસાફરો મારી જેમ લાંબી પ્રતિક્ષામાં હોય તો પાટલી કે જમીન પર મસ્તીથી ઊંઘ ખેંચી લેતા. સતત વાગતા ભૂંગણાથી ખલેલ થતી

ઉંઘમાંથી કોઈક મુસાફર ડોકિયું બહાર કાઢી, સમય જોઈ, ફરી રજાઈ-બ્લેન્કેટમાં ટબુરાઈ જતો. મારી પ્રતીક્ષાની પણો પણ લાંબી હતી. હજ ચાર કલાક બેંચવાના હતા. ટ્રેનમાં બેસીને જ ઉંઘ બેંચી લઈશ અને વહેલી સવારે પશ્ચિમ બંગાળ કલકત્તા પહોંચી જઈશ, એ વિચારે જ રોમાંચિત હતી. મારા વતન કચ્છના કેટલાક લોકો કલકત્તામાં રહેતા હતા એ ભાઈઓ સાથે મારા ગુરુજીએ મારા રહેવા બાબત વાત કરી લીધી હતી એટલે હું થોડી નિશ્ચિત પણ હતી. આવતી કાલનો આખો દિવસ કલકત્તા જોવા માટે મળી રહેશે એવું ધાર્યું હતું. 'ધૂમકડી દિલ સે' ટ્રાવેલ ચુપના મારા મિત્ર કિશન બાહેતીજી જેઓ કલકત્તા રહેતા હતા એમને પણ મેસેજ કરી દીધો હતો. આવતીકાલે હું કલકત્તા આવીશ, જેન ધર્મશાળામાં રોકાઈશ અને સમય મળશે તો મળવાનું પણ ગોઈવીશ એ ચર્ચા કિશનજી સાથે થઈ ગઈ હતી. સમય પસાર કરવા મેં હવે મારા ભ્રમણાંત્રનો સહારો લીધો. ધણા દિવસના ભેગા થઈ ગયેલા સંદેશાઓ જોયા, જવાબ આપ્યા અને ફોન પર વાત પણ કરી.

પણ આ તો શિયાળાની લાંબી, કાળી, ઠંડી રાત....! આમ જલ્દી થોડી પસાર થાય? એકલ મહિલાને આમ લાંબા સમયથી બેઠેલ જોઈ ધણા સહયાત્રીઓને હૃતૂહલ પણ થયા કરતું. મારા પછી આવેલ મુસાફરો પણ એક પ્રશ્નભરી નજર છોડી પોતાની ગાડી આવતા નીકળી જતા. ત્રણ બેગસની આસપાસ જેકેટ અને સાલમાં જાતને સંકોચીને હું ઓટલા પર બેઠી હતી. ટ્રેનરાણીના આગમનથી સૂચના-પટલ વારંવાર ગૂંજું ઉઠતું... 'બા મુલાહીજા..! સાવધાન..!' "હાવડા કી ઓર ...ટ્રેન નંબર..ખેટફોર્મ નંબર.. પર આ રહી હૈ.." હોશિયાર..! દરેક સાવધ મુસાફર પોતાના ગંતવ્ય જવા તૈયાર થઈ બહાર નીકળી જતા. હું શાંતિથી મારી ટ્રેનની પ્રતીક્ષા કરી રહી હતી. દસ વાગ્યે મારી ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું. 'દહેરાદૂન સે હાવડા કી ઓર જાનેવાલી ટ્રેન નંબર... દૂન એક્સપ્રેસ એક ધંટા દેરી સે ચલ રહી હૈ..' મતલબ ૧૧:૩૦ના હવે ૧૨:૩૦ થશે ! એક સહયાત્રીએ પૂછી પણ લીધું, 'આપ કો કહીં જાના હૈ? અકેલી હું આપ? યહાં કબ તક અકેલે બેઠેંગી..? બ્લાઇ બ્લાઇ...'

આવા સમયે સંજોગોને પારખી ટૂંકો જવાબ આપી ચૂપ થઈ જવું અથવા ઉપેક્ષા કરવી જ રહી. નહીં તો અવનવા સવાલો અને સલાહોનો વરસાદ વરસતો રહે.

આ યાત્રીને ખબર હતી હું ક્યારથી એકલી મારી મસ્તીમાં અહીં બેઠી છું. ૧૧ વાગ્યે એની ટ્રેનનું ભૂંગણું વાગતાં મને સલામ કરી એ સરકી ગયો. પ્રતીક્ષાલયમાં હવે હું અને બીજા બે-ચાર મુસાફરો બસ...! હું મારા સામાનને કારણે બેદરકારીથી એકાદ ઝોકું પણ ખાઈ શકું તેમ નહોતી. ભૂંગણું પણ હવે શાંત હતું. મોડી રાતે ટ્રેનો પણ ઓછી થવા લાગી. ૧૧:૦૦ વાગે બીજાવાર એનાઉન્સમેન્ટ થયું કે મારી ટ્રેન અહીં કલાક મોડી ચાલી રહી છે. હવે કલાકે કલાકે મારી ટ્રેન મોડી ચાલી રહી છે તેનું અનાઉસ્સિંગ થતું રહ્યું. હું સમજ ગઈ હતી કે આ 'દૂન' ટ્રેને પોતાનો પરચો બતાવી દીધો છે. ભારતના કોઈ પણ સ્થાને જતી દૂન ટ્રેન ૧૦-૧૨ કલાક મોડી ન પડે તો એ દૂન ટ્રેન શેની? ખેટફોર્મ પર વાગતું ભૂંગણું મને મારી ટ્રેનથી દૂર કરી રહ્યું હતું અને મૂંજવણના પાસમાં જકડી રહ્યું હતું. વધતી જતી ઠંડી અને ભાલી થતાં જતાં પ્રતીક્ષાલયે મને થોડી ભયજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. બે-ચાર મુસાફરો પણ અઢી વાગે એમની ટ્રેન આવતા જતાં રહ્યાં. જતાં જતાં ચિંતા વ્યક્ત કરતાં ગયા કે, 'બહનજી આપ યહાં કબ સે બેઠી હું, આપકો કહાં જાના હૈ? જવાબ તો આપી દીધો, પણ અંદર કોલાહલ મચી રહ્યો હતો એનું શું? રાત્રી અને એમાંય વળી એકલતા...એનો કોઈ ફાયદો પણ ઉઠાવે એ વિચારમાત્રથી ભય લાગવા માંડ્યો. ૭-૮ ડિગ્રી નીચે ગયેલ તાપમાન હવે ૩-૪ ડિગ્રી સુધી જતું રહ્યું હતું. ઠંડીથી અને સતત બેસી રહેવાથી શરીર અકડાઈ ગયું હતું. આંખો વારંવાર ધેરાઈ જતી. જરાક જોકો ખાઈ લઈ.. એ વિચાર પણ ભય ભરેલો લાગતો હતો. કોઈ શુભેચ્છા આપી નીકળી ગયું તો કોઈની ઘૂરતી નજર સાવધ કરી ગયું.

મધ્યરાત્રી વિતી ચુકી હતી અને ખેટફોર્મ પર આવતી ગાડીઓનો અનાઉસ્સિંગનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. ખામોશીની એક એક પળ હવે ભારી જઈ રહી હતી. પ્રતીક્ષાલયમાં અચાનક કોઈ માણસનું આવી અને ડોકીયું કરી, જતા રહેવું પણ ભયસૂચક લાગતું. તો વળી ભાલી પ્રતીક્ષાલય પણ વધુ જોખમી ભાસતું. આટલા નાનકડા સ્ટેશન પર સુરક્ષા કર્મચારીની આશા રાખવી પણ અસ્થાને હતી. આવા ભયની વચ્ચે જો કોઈ મારો સાથી હોય તો તે હતો એક જ મોબાઈલ.

ભૂંગણાનો અવાજ થતાં જ આશા બંધાતી કે હવે તો ટ્રેન નજીક પહોંચી આવી હશે. પણ 'સર્વ આશ નિરાશ.' નવલા વર્ષની પહેલી રાત આવી ભયાવહ હશે

એવું તો વિચાર્યુ જ નહોતું! અદ્ધી રાત્રી વીતી ગઈ. સ્વસ્થ મને ત્રીજો પહોર પણ પસાર કર્યો. ભળભાખળું થવા આવ્યું. ધીરેધીરે પક્ષીઓનો કલરવ પણ સંભળતો થયો. પરોઠ થઈ. થોડીવારે સૂર્યનારાયણ પણ રથ પર સવાર થઇને નીકળી પડ્યા પણ હું અહીં છેલ્લાં કેટલાય કલાકોથી સ્થગિત ગઈ હતી. છેલ્લાં દોઢ કલાકથી અનાઉસિંગ પણ બંધ હતું! ટ્રેન નીકળી તો નથી ગઈ?

એવું કેમ બને? મારી અધીરાઈ વધતી ગઈ. મારી ટ્રેનનો કલકત્તા પહોંચવાનો સમય થઈ ગયેલ પણ હજુ સુધી એ પારસનાથ રેલવે સ્ટેશન પર પણ નહોતી પહોંચી! ટ્રેનનું લાઈલ સ્ટેટ્સ હજુ અહીં પહોંચવા માટે એક કલાક બતાવી રહ્યું હતું. તત્કાલ ટિકિટ કઢાવી દેનાર સમીરભાઈએ ના પાડવા છતાં મેં આ ટ્રેનની ટિકિટ કઢાવી. બીજી ટ્રેનો મોડી રાત્રે ઉપડતી હતી તો કોઈક મોડી કલકત્તા પહોંચાડતી હતી. મારો આખો દિવસ ટ્રેનમાં તુટ્ટે એવું લાગવાથી મેં આ ટ્રેનની ટિકિટ લીધી. બીજી ટ્રેનો તો મધ્યરાત્રીએ નીકળી પણ ગઈ અને કલકત્તાની નજીદીક પણ પહોંચી ગઈ હશે! જ્યારે મારી ટ્રેનનો કલકત્તા પહોંચવાનો સમય થઈ ગયો હોવા છતાં, પારસનાથ રેલવે સ્ટેશન પર પહોંચવાનો પત્તો ન હતો. મારી અધીરાઈ અને ડર હવે વધી ગયા. છીલ્લી કષણો એનાઉન્સમેન્ટ થાય અને પ્લેટફોર્મ બદલવું પડે તો મારી શું વલે થાય? ત્યાં તો અચાનક કાને શબ્દો પડ્યા, ‘પ્લેટફોર્મ નંબર તીન પર હાવડા કી ઓર જાનેવાલી દહેરાદૂન હાવડા એક્સપ્રેસ આ રહી હૈ.’

એક કલાક દૂર બતાવતી ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી છે! એવું સાંભળી હું તો બેબાકળી થઈ ગઈ! આટલા દૂંકા સમયમાં ત્રણ બેંસ સાથે ત્રણ નંબર પ્લેટફોર્મ પર કેવી રીતે પહોંચીશ? આખા શરીરે ભયની લહેરખીઓ દોડી ગઈ. હું સામાન લઈ હાંકળીફાંકળી બહાર દોડી. સુમસામ સ્ટેશન પર કોઈ કૂલી કે મદદગાર ન દેખાયો. ફટાફટ બે બેંસ લઈ ફ્લાયઓવર ચી ને બેંસ મુકી, ત્રીજી બેગ લેવા નીચે દોડતી ઉત્તરી, લઈને સીધી પ્લેટફોર્મ નંબર ત્રણ પર મૂકી પાછી ઉપર.. બે બેંસ લઈ નીચે આવી. ત્યાં સુધીમાં તો ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ હતી! મારો કોચ કેમ શોધવો? ઓનલાઈન કોચ જોવાનો સમય પણ નહોતો. ચાલતી ટ્રેનમાં કોચ શોધતી સામાનને ફસડતી માંડ માંડ મારા કોચ સુધી પહોંચી. ટ્રેન ઉપડવાની સીટી વાગી અને હું

હજુ પ્લેટફોર્મ પર..! એક દરવાજેથી સામાન અંદર ફેંક્યો, બીજે દરવાજેથી ચાલતી ટ્રેનમાં ચી! હશ! જ્ય હો ભારત! જ્ય હો દૂન ટ્રેન! બાર કલાકના ઈંતજાર પછી, આઠ કલાક મોડી ચાલતી ટ્રેનને મેં પકડી તો પારી! વાહ રે! રેલે સુવિધાઓ અને સમય-સારિણી! મેં મારો હાથે જ પગે કુહાડો મારેલો તો પીડા તો ભોગવવું જ રહ્યું.

હજુ તો સીટ પર સેટ થઈ શરીરને લંબાવું ત્યાં તો મારો ફોન રણકી ઉઠ્યો.

‘જ્યોતિ બહન! કલકત્તા મેં આપકા સ્વાગત હૈ! ગુડ મોર્નિંગ! કહાં પહોંચી?’

‘હે ભગવાન કિશન બૈયા, જરા ટ્રેન કા લાઈલ સ્ટેટ્સ દેખ્યો.’

‘ધત તેરી કી...! આપ તો અભી પારસનાથ રેલવે સ્ટેશન સે નીકળી હો? અજ્જબ હૈ.. મુજે તો લગા થા ક્રિ હમ સુબહ કી ચાય સાથ પીયેંગો... અબ તો કર લો બાતો! આપ તો દોપહર તક ભી આને સે રહી! ખેર! મૈં આપકે કોન્ટેક્ટ મેં રહેતા હું. હાવડા પહુંચ્યો તથ બતા દેના. કુછ જાનના-પૂછના હો તો ભી બતા દેના. કોઈ દિક્કિ હો તો મૈં ગાઈડ કર દુંગા. શામ કો મિલતે હૈ કોઝી પે..!’ ‘ઠીક હૈ કિશનબૈયા. હાવડા પહોંચને કે બાદ ફોન કરુંગી. અબ આપ કામ પર જાને કે લિયે ઉઠ જાઈએ ઔર મૈં સો જાતી હું. રાતભર નીંદ નહીં હુંદ ન...!’

નવલા વર્ષની મારી પહેલી રાત ચોવીસ કલાકે માંડ પડી રહી...! પણ ઊગતો સૂરજ મને નિદ્રાવસ્થામાં લઈ જઈ રહ્યો હતો મારા સ્વન્ધલોક ભણી....

\*\*\*


(કુ. જ્યોતિબેન મોતા મૂળે કચ્છ નાનીખાખરના વતની પણ વર્ષાથી મુંબઈમાં સ્થિર થયા છે. પ્રવાસ, પ્રકૃતિ અને પરમ સાથેનું અનુસંધાન એમનાં જીવનમાં મધ્યાનતા ધરાવે છે. ભારતના વિભિન્ન પ્રદેશોથી માંત્રિને નેપાળ, ભૂતાન જેવાં દેશોનો એકલ પ્રવાસ આ સાહસિક મહિલાએ ઓછામાં ઓછા ખર્ચ વિશિષ્ટ રીતે કર્યો છે. એમની પાસે દિમાલયની ગોદમાં રખડવાના તો ફુર્લબ તીર્થસ્થળોમાં ભમવાના એક અનુભવોનું ભાથું છે. તેમની કલમ અનુભવથી રચાયેલી છે એટલે એમનાં પ્રવાસના લખાણો અન્ય પ્રવાસીઓ માટે ઘણાં ઉપકારક પણ બની રહે છે. નાનીનાની વિગતોને સૂક્ષ્મતમ સંવેદનોથી સભર તેમનાં લખાણો ભાવકને સહપ્રવાસનો અનુભવ કરાવે છે.)

-જ્યોતિબેન મોતા

## ૩૦મી પુષ્પતિથિએ શ્રદ્ધાંજલિ



: જન્મ :  
તા. ૨૨-૦૭-૧૯૯૮



: સ્વર્ગવાસ :  
તા. ૧૫-૦૮-૧૯૯૧

### પૂજ્ય પિતાશ્રી વ્રજલાલ બેચરદાસ મહેતા (વડાલવાળા)

દેહ આથમે છે પણ.... દેહમાં જ દિવ્ય શાંતિ અને જેત ભર્યા હોય એનો કદી અંત થતો નથી.  
વહેલી પ્રભાતે પંખીઓનું સંગીત અમને જગાડે છે ત્યારે આપનું સ્મરણ થાય છે.  
મનને પવિત્ર અને આનંદવિભોર કરતો મંદિરનો ઘંટનાદ આપની હાજરીનો અહેસાસ કરાવે છે.  
જુદા જુદા સ્વરૂપે આપ હંમેશાં અમારી સાથે જ છો તો પછી કેમ કહેવાય કે  
આપણી વર્ષ્યે અંતર પડી ગયું? આપ રહેશો નિત્ય અમારા સ્મરણમાં

### મુક્તાબહેન વ્રજલાલ મહેતા પરિવાર

પુત્ર - પુત્રવધૂ : હરિકિશન - ઇન્હુમતિ, જ્યંત - શોભના  
પુત્રી : હેમલતા શશીકાન્ત પારેખ • પૌત્ર : દિવ્યેશ • પૌત્રવધૂ : દીપિતિ  
પૌત્રી : ભાવના નિમેષકુમાર શેઠ • પૌત્રીઓ : એકતા, તૃપ્તિ, હેતલ, ચીરાગ, વેજાણી • દોહીતા : પૂજન

### જ્યંત વી. મહેતા

૬૦૧/૬૦૨, સિદ્ધિ હારમોની બિલિંગ્સ, ખોટ નં. ૨૮, આમચી શાળા લેન,  
આર.એ.સ. મણી માર્કેટ પાસે, તિલક નગર, ચેમ્બુર, મુંબઈ - ૪૦૦ ૦૮૮. ફોન : ૩૪૮૪૬૦૧૮  
મો. ૯૮૨૦૦૨૫૬૭૪ / ૯૮૧૯૯૭૧૨૧૩ / ૯૮૨૦૩૫૨૮૨૯ / ૯૮૨૦૯૨૫૬૭૪

# જ્ઞાન કસોટી

યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના જીવનને આધારે  
નીચેના પ્રશ્નોના જવાબ આપો.

- યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના જીવનને આધારે  
નીચેના પ્રશ્નોના જવાબ આપો.

૬૧) બીજા ભવમાં ભગવાન શ્રી ઋષભદેવનો જન્મ ક્યાં થયો?

૬૨) એ પ્રદેશમાં હંમેશા ક્યો આરો હોય છે? તેનું નામ આપો.

૬૩) બીજા ભવમાં પ્રભુના જન્મનું સ્વરૂપ ક્યું હતું?

૬૪) યુગલિની યુગલ સંતાનને જન્મ ક્યારે આપે છે?

૬૫) યુગલિક બાળકો બીજા સપ્તાહમાં શું શીખે છે?

૬૬) પ્રથમ આરાના યુગલિકો સ્વભાવથી કેટલી જાતિના અને કઈ ગંધવાળા હોય છે?

૬૭) યુગલિયાનું આયુષ્ય કેટલું હોય છે?

૬૮) યુગલિયાની અવગાહના કેટલી હોય છે?

૬૯) કેટલા દિવસ પછી યુગલિયાને ખાવાની ઈચ્છા થાય છે?

૭૦) યુગલિયાના શરીરમાં પાંસળી કેટલી હોય છે?

૭૧) પ્રથમ આરાના યુગલિકોનો ખોરાક કેટલો અને ક્યો હોય છે?

૭૨) તે યુગલિકો ક્યા સંઘયણવાળા હોય છે?

૭૩) તે યુગલિક કેમ કહેવા છે?

૭૪) માતા-પિતા યુગલિક સંતાનનું પાલન કેટલા દિવસ સુધી કરે છે?

૭૫) તે યુગલિયા ક્યા દોષોથી રહિત હોય છે?

૭૬) તે યુગલિકાતેનું આયુષ્ય પૂર્ણ કેવી રીતે થાય છે?

૭૭) યુગલિકોનું શરીર ક્યા સંસ્થાનવાળું હોય છે?

૭૮) યુગલિકોની જરૂરિયાતો કોણ પૂરી કરે છે?

૭૯) આ યુગલિકો ઉપર કોનો ઉપદ્રવ હોતો નથી?

૮૦) યુગલિકો મરીને ક્યા દેવલોક સુધી જઈ શકે છે?

૮૧) કલ્યવૃક્ષ એટલે શું?

૮૨) કલ્યવૃક્ષ કેટલા પ્રકારના છે અને તે કેવા પદાર્થ આપે છે?

૮૩) દીપક જેવું અજવાણું દેનારા કલ્યવૃક્ષનું નામ શું છે?

૮૪) સૂર્ય સમાન પ્રકાશ આપનારા કલ્યવૃક્ષ કયા છે?

૮૫) 'ચિત્રાંગ' કલ્યવૃક્ષ શું આપે છે?

૮૬) સર્વ પ્રકારના આભુષણો કયું કલ્યવૃક્ષ આપે છે?

૮૭) આરોગ્યને પુષ્ટ કરે એવા મધુર ફળ-કૂલને આપનારા કયા કલ્યવૃક્ષ છે?

૮૮) 'તૂર્યાંગ' કલ્યવૃક્ષ કેટલા પ્રકારના વાદ્યો સંભળાવે છે? બે નામ આપો.

૮૯) અઠાર પ્રકારના ભોજન અને મિઠાઈઓ કયું કલ્યવૃક્ષ આપે છે?

૯૦) ઋષભદેવનો આત્મા યુગલિકના ભવમાં કેવા સુખનો ઉપભોગ કરે છે?

## ત્રૈવીસમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી



જન્મ : તા. ૨૮-૧૦-૧૯૪૪



સ્વર્ગવાસ : તા. ૨૩-૦૮-૧૯૯૮

### અ. સૌ. ચંદ્રિકાબેન શાશ્વત વોરા

જેણે આ ધરતી પર ફૂલ જેવી સુગંધ પ્રસરાવી છે,  
જેણે દુઃખ સહીને લહાણી કરી છે,  
જેણે જીવનમાં જેર પયાવી અમૃત પિરસ્યું છે,  
જેણે સ્મિત વેરીને સર્વના જીવનમાં મીઠાશ આણી છે,  
જેણે મન જીવ્યું છે અને આસક્તિને હણી છે,  
તેઓને મુક્તિ સમીપ હોય છે.  
લી.

સ્વ. ગીરધરલાલ જીવનભાઈ વોરા

શાશ્વત ગીરધરલાલ વોરા

કેજલ શાશ્વત વોરા

સપના કેજલ વોરા

કવિતા જગદીપ શેઠ

પુનિતા રાજેન શાહ

હેત, હેતાંશી

## ધતિંગા

એ બંગલાના વિશાળ કમ્પાઉન્ડના એક છેવાડે હતી. તેમનાં માથાં પર ઘાસ છાયેલું હતું અને પછી તેના પર મોટાં તાડપત્રો મૂકી દોરીથી તે બાંધી દીધેલાં હતાં. ઝૂપડીઓનાં બારણાં વાંસની ખપાટોનાં બનેલાં હતાં. હવે ઉનાળો નજીક આવ્યો હતો અને ખપાટો પર લીધેલી માટી ખરી ગઈ હતી; અને એની તિરાડમાંથી સાંજનો પવન ઝૂપડીમાં પ્રવેશી શકતો. દિવસ ગરમ રહેતો, પણ રાત સારી પેઢે શીતળ થઈ જતી અને હવામાનના વધુ પડતા આ ફેરફારની અસર તળે ચોકઠામાંથી ક્યાંક છૂટી પડી ગયેલી વાંસની ખપાટો હળવો કિચ્ચૂડાટ કરતી. બુઢ્હા દેવજીએ એને પીજારામાં પુરાયેલા વાંસનું સંગીત કર્યું ત્યારે નાનકડી હીર ખુશ થઈ ગઈ. આમ તો મમ્મીએ તેને આ તરફ આવવાની ઘણી વાર ના પાડી હતી, પણ આજે પવનમાં હાલતાં પાંડાંના ધીમા સરસર અવાજ સાથે કશીક સુગંધ ગાતી હોય તેમ તેને લાગ્યું અને એથી તે ત્યાં બેંચાઈ હતી. બહુ પવન આવે ત્યારે ઉપરથી નીચે સુધી પાંડાં જોરથી જૂલો ખાય, ડાળીઓ વીજાય ને એકમેક સાથે અથડાઈ તડાક-તડાક અવાજો કરે.... એવે વખતે હીરને લાગતું કે ઝડ ગાય છે ને નાચે છે. એક વાર પહોળાં પાન વચ્ચેથી પવન જોરથી વહી ગયો અને બે પાન આપસમાં અથડાયાં ત્યારે ટપાક એવો ઘેરો મંદ અવાજ આવ્યો. તે ઘરનાં બારણામાં મમ્મી સાથે ઊભી હતી અને તેણે એકદમ ખુશ થઈ જઈને મમ્મી તરફ ફરીને કહ્યું : ‘પાંડાં તાળી પાડે છે !’

‘એ તાળી નથી, પાંડાં કદી તાળી પાડે નહિ. એ તો પવનને લીધો અવાજ થાય છે,’ મમ્મીએ સાવચેતીથી, હસીને કહ્યું : પણ હીરને એ બહુ લૂખું-સૂકું લાગ્યું. મમ્મી ને પદ્ધા બંને આમ જ

કહેતાં. પવન એટલે પવન, તે કાંઈ વાંસળી નહિ. પાંડાં એટલે પાંડાં. પછી તે સાવ કૂણા નાનકડાં હોય કે પીળાં ને ઘરડાં ખખ હોય. પાંડાં તે પાંડાં, તે કાંઈ ડાળીની પાતળી આંગળીઓ નહિ.

મમ્મી ને પદ્ધા દરેક વસ્તુને તેના નામે જ ઓળખતાં અને હીર બીજું નામ આપવા જાય ત્યારે સ્પષ્ટ ના પાડતાં, ‘આપણો આરોપિત સત્ય નહિ, અવસ્તુગત સત્ય શોધવાનું છે –’ એમ તેઓ મિત્રો સાથેની ચર્ચાઓમાં કહેતાં. હીર તેમની વાતો સમજતી નહિ, પણ તેને કાને વારંવાર ‘બૌદ્ધિકો’ અને ‘સત્યની શોધ’ અને ‘મુક્ત ચેતના’ જેવા શબ્દો અથડાતા. મમ્મી ને પદ્ધા બંને વિજ્ઞાની હતાં અને વિવિધ સંશોધનો કરતાં હતાં. સવારસાંજ, બપોરરાત તેઓ કામમાં, પુસ્તકોમાં, ચર્ચામાં દૂબેલાં રહેતાં. અલબના, મમ્મીએ દિવસના ગજા કલાક હીરને આપવા જ, એમ નક્કી કરેલું. અને એ વખતે બીજા બધા કામ છોડી, મહેમાનો આવ્યાં હોય તો તેમનેય મૂકી તે હીર સાથે બગીચામાં ફરવા જતી. મા તરીકેની ફરજ વિશે તે ઘણી સભાન હતી અને પોતાના કામના રોકાણ કે વ્યવસાયને લીધે હીરના વિકાસમાં સહેજ પણ ક્ષતિ ન આવવી જોઈએ, એમ તે દફપણો માનતી. તેના પદ્ધા પણ રોજ તેની સાથે થોડો વખત ગાળતા. તે બહુ નાની હતી ત્યારે તેની સાથે ઘોડો ઘોડો રમતા, પછી ચિત્રોવાળી ચોપડી સાથે વાંચતા, અને હવે તેના અભ્યાસમાં મદદ કરતા.

આમ છતાં કંઈક ખૂટતું હતું. અથવા હીરને એમ લાગતું કે કંઈક ખૂટે છે. શું - તેની તેને સમજ નહોતી પડતી. તે હજુ ઘણી નાની હતી અને થોડા શબ્દોનો જ હજુ તેને આત્મિયપણો પરિચય થયો હતો. વિજ્ઞાની માબાપની દીકરી હોવા છતાં, ‘આ એટલે આ,’ ‘અહીં,’ ‘આમ’, એવી સ્પષ્ટતા તેને હજુ મળી નહોતી. તેને પડછાયા પહાડ જેવા લાગતા,

કૂલ પરીના હાસ્ય જેવું લાગતું અને વરસાદ આવે ત્યારે કૂલો પલળી જશે અને પરીઓને શરદી થશે એવી તેને બીક લાગતી હતી. પણ આ વાત તે કોઈને કરી શકે તેમ નહોતી. ઘરમાં તેના જેવણું બીજું કોઈ નહોતું. તેને સાચવનારી આયા દૂધમાં પ્રોટિનેક્સ બરોબર હલાવીને તેને આપતી અને ખુલ્લી હવામાં તેને ફરવા લઈ જતી. પણ તે આકાશમાં પડેલાં ચમકદાર કાણાંઓ વિશે અને પાણીમાં તરતી જતી શાંતિ વિશે કશું જ નહોતી જાણતી.

તેથી જ આજે તે અજાણી સુગંધથી ખેંચાઈને કમ્પાઉન્ડના પાછલા ભાગમાં ચાલી ગઈ અને દેવજીએ વાંસના કિચૂડાટને કિચૂડાટ ન કહેતાં સંગીત કહ્યું ત્યારે તેને થયું કે અહીં કોઈક એવું છે જેની સાથે સમાનભાવે વાત કરી શકાય.

બુદ્ધો દેવજી એક નવી ખાટલી પર બેઠો હતો. ખાટલી એક મોટા લીમડાના ઝાડ તળે હતી. લીમડાને ઘણાંબધાં સરેર કૂલ બેઠાં હતાં. પવનના એક ઝપાટો આવતાં સંખ્યાબંધ કૂલો નીચે ખરી પડ્યાં અને એક મદમધુર સુગંધ હવામાં ફેલાઈ ગઈ.

આ સુગંધ આજ પહેલાં હીરે કદી જાણી નહોતી. તેણે નવાઈ પામીને પૂછ્યું : ‘એ શું છે દાદા?’ અને દેવજીએ આનંદથી કહ્યું : ‘તું આવી એટલે આ લીમડો ને એનાં કૂલ બહુ રાજુ થયાં, બેટા!’

ઝાડ કાંઈ માણસ નથી. ઝાડને જોઈને આપણો રાજુ થઈએ, પણ ઝાડ કાંઈ આપણને જોઈને રાજુ ન થાય - મમ્મીએ એક વાર કહેલું. ઝાડ રાજુ ન થાય, ઝાડ નાચે નહિ, ખુશ થઈને તાળીઓ પાડે નહિ, મૂગું મૂગું ઊભું રહે.

પણ હીરની વાત જુદી હતી. સહેજ વિચાર કરીને તે બોલી : ‘ઝાડ બોલી તો શકે, ખરું ને દાદા?’

દેવજીની ધોળી દાઢી સાંજની હવામાં ફરફરી રહી અને વૃદ્ધાવસ્થામાં પણ સહેજે ઝાંખી નહિ પડેલી તેની આંખો કશાક રહસ્યથી ચમકી રહી. તેણે પૂછ્યું

: ‘તે સાંભળ્યું છે કદી?’

‘હા, એક વાર - બપોરે.’

એ બપોર છે એમ ખબર ન પડે એવી બપોર હતી. કાળાં કાળાં વાદળથી વીટળાયેલી અને બધો તડકો ખોઈ બેઠેલી બપોર. હીર ઘરનાં પગથિયાં પાસે ઊભી હતી. ચારે બાજુ ધોર સ્તબ્ધતા હતી. બધું જાણો કોઈક ચુપકીદીની કેદમાં પુરાઈ ગયું હતું. ક્યાંય હલનચલન નહિ, અવાજ નહિ, ગતિ નહિ, કિરણ નહિ, છાયા નહિ...

અને પછી વરસાદનું એક બુંદ ટપક્યું, બીજું ટપક્યું, ગીજું ટપક્યું. અને ઘર સામે ઊભેલો પીપળો જે રીતે ટપટપ કરી ઊઠ્યો તે સાંભળીને હીરને થયેલું કે એ ચોક્કસ વરસાદને કશું કહે છે.

એ વાત તે ભૂલી નહોતી, પણ મમ્મીને એ કહેવાની તેની હિંમત ચાલી નહોતી.

આજે દેવજીની આંખોમાં આંખ માંડી નિર્દોષતાથી તેણે કહ્યું : ‘હા, એક વાર મેં પીપળાને બોલતાં સાંભળેલો.’ પછી અચાનક તેને કાંઈક સૂરજનું ને તેણે પૂછ્યું, ‘વાદળાં એ આકાશનાં ઝાડ છે, દાદા?’ દેવજીએ ઝાડું ધુણાવ્યું ને તે હસ્યો : ‘અને વરસાદનાં ટીપાં એ તેનાં ધોળાં ધોળાં કૂલ છે.’

હીરને થયું કે વરસાદનાં ટીપાંને ઝાડ પર વરસવું ગમતું હશે, પણ એને કાદવકીયડમાં પડવાનું તો સહેજે નહિ ગમતું હોય. તે મનમાં જ હસી.

અચાનક જ, ખાટલા પાસે ઢોળાયેલા પાણીનું એક નાનું ખામણું ભરાયું હતું, તે અતંત તેજસ્વી સોનેરી રંગથી એવું જણક જણક થઈ ઊઠ્યું કે હીરના મૌખાંથી એક નાનકડી ચીસ નીકળી ગઈ: ‘એ શું છે, દાદા?’

‘એ સૂરજ છે, દીકરી! સૂરજ નીચે આવ્યો છે, પાણી સાથે રમવા.’

હીરે માં ઊચું કરી પશ્ચિમ દિશા ભડી જોયું. લીમડાનાં જીણાં જીણાં પાન વચ્ચેથી સૂર્યનો તેજસ્વી લાલ ગોળો દેખાયો.

દેવજી સાથે તેને મજા આવી ગઈ હતી અને તે જે મનમાં આવે તે સીધેસીધું બોલી શકતી હતી. તેણે પૂછ્યું : ‘સૂરજ શું છે, દાદા?’

દેવજીએ સૂરજ તરફ જોયું, અનાયાસ સંધ્યાવંદન કરતો હોય એમ તેના હાથ જોડાયા ને તેણે કહ્યું : ‘સૂરજ ભગવાનનું મૌં છે, બેટા!’

ભગવાન -

એક વાર આયાએ તેને આ શબ્દ આપેલો, પણ પોતે હજ તેની સાથે દોસ્તી કરે તે પહેલાં મમ્મીએ એ શબ્દને લઈને બહુ દૂર ફેંકી દીધો હતો.

ભગવાન શબ્દ તેને ગમ્યો. ‘ભગવાન આકાશમાં છે?’ તેણે પૂછ્યું.

‘આકાશમાં અને પૃથ્વી પર - બધે જ ભગવાન છે.’ દેવજીનો અવાજ મૃદુ થઈ ગયો.

‘બધે જ? આ લીમડામાં પણ?’

‘આ ખરી પડેલાં ફૂલમાં પણ. આ ઘાસમાં, આ પાણીમાં તરતા મ્રકાશમાં, આ ટુકડામાં પણ.’ દેવજીએ પાસે પડેલી એક સુક્કી વાંક વળાંકવાળી કાળી ડાળીનો ટુકડો હાથમાં ઉંચક્યો. ‘આ ટુકડામાં પણ.’

હીરે એ ટુકડો હાથમાં લીધો ને એને હેરવીફેરવીને જોયો : ‘આમાં ભગવાન છે?’

‘કણોકણામાં ભગવાન જ છે...’ વૃદ્ધે તેનો હાથ હીરના માથા પર મૂક્યો. હીર ચુપચાપ સાંભળી રહી. ‘ભગવાન હજારો જુદી જુદી બોલીઓમાં વાત કરે છે; અને ઝડપાન પણ તેમની એક બોલી જ છે.’ એની મારફત તે આપણી સાથે વાતો કરે છે.’ દેવજીએ ફરી કહ્યું અને પછી તે મૌન થઈ ગયો અને હીરને લાગ્યું કે એનું ચૂપ હોવું તે કશાક સંગીતમાં ઓગળી જાય છે. તે વધુ ચૂપ થઈ ગઈ અને તેને ઘાસની પતીઓ, માટીમાં પડેલા કંકરા, સૂરજનું છેલ્લું કિરણ અને આકાશનો નીલ-ધોરાતો રંગ અશાય સૂરે ગાતાં સંભળાયાં.

છેવટે સૂરજ આથમી ગયો અને ઝડપાન પાંડડાને ફૂલ એકમેકમાં લપાઈ ગયાં ત્યારે તે ઊભી થઈ.

તેને કંઈક યાદ આવ્યું ને તેણે પૂછ્યું : ‘દાદા, તમને મોદું નથી થયું?’

‘મોદું? શાનું મોદું, બેટા?’

મમ્મીને-પચ્ચાને હમેશાં મોદું થતું.

કેટલી વાર તેઓ કહેતાં - ‘બહુ મોદું થઈ ગયું.’ આજે પોતાનેય મોદું થઈ ગયું હતું :

‘આ લીમડાને કદી મોદું નથી થતું,’ દેવજી લહેરથી હસ્યો ને પછી હીર લાકડાના ટુકડાને અને ખરી પડેલાં ફૂલને લઈને ઘેર ચાલી ગઈ.

એ રાતે તેણે પોતાની એક જૂની ઢાંગલીને રેશમી ઓઢણી પહેરાવી હતી તે કાઢી લઈને રૂમના ખૂણામાં પાથરી; એ પછી તેના પર સુક્કી ડાળીનો ટુકડો ગોઠવ્યો અને તેની પાસે લીમડાનાં ચીમળાઈ ગયેલાં ફૂલ તે મૂકવા જતી હતી ત્યાં તેની મમ્મી રૂમમાં આવી અને ચમકીને ઊભી રહી : ‘શું કરે છે, હીર?’

‘ભગવાન સાથે વાતો કરું છું.’

ભગવાન! મમ્મીના કપાળમાં કરચલી પડી. તે આગળ આવી. એક હાથે તેણે હીરની આંગળી પકડી તેને ઊભી કરી અને બીજા હાથે તેણે લાકડાનો ટુકડો હળવેથી ઉંચકી લીધો : ‘આ તો લીમડાની તૂટેલી ડાળખી છે -’ તેણે હીરને સમજાવતાં કહ્યું અને, ‘આવો કચરો ઘરમાં એકઠો ન કરવો જોઈએ,’ એમ કહી તેણે એને બારીની બહાર ફેંકી દીધો. એમ કરતાં તેને દુઃખ થયું, પણ પોતાની દીકરી ભાવધેલી, અંધશ્રદ્ધા અને પૂર્વમાન્યતાઓથી પકડાયેલી, પરંપરાદત સંસ્કારોમાં જકડાયેલી બને એવી તેની ઈચ્છા નહોતી. તે તો ઈચ્છતી હતી કે હીર મોટી થઈને પદાર્થોનું અને મનુષ્યોનું, જીવનનું અને દુનિયાનું સત્ય શું છે તે જાતે જ શોધી કાઢે.

હીરને આજે તેણે પોતે જ દૂધ પિવડાયું, તેને માથે વહાલથી હાથ ફેરવી પથારીમાં સુવડાવી અને પછી બાળગીતોની એક રેકર્ડ વગાડી... અને નજીક આવી ઊભેલા પતિને કહ્યું : ‘છોકરી કોને ખબર આવા ધતિંગ કયાંથી શીખી લાવે છે!’

- કુંદનિકા કાપડિયા

# ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ



**સ્વ. અતેન્દ્ર કાંતિલાલ મહેતા  
અતુભાઈ (ફ્રેસવાલા)  
(છોડવડી હાલ મુલુંડ)**

જન્મ તારીખ : ૨૨-૧૧-૧૯૫૫  
સ્વ. તારીખ : ૦૪-૦૮-૨૦૨૦

અંજલી આપતા હૈયું તૂટે છે, શ્રદ્ધાંજલિ લખતા શાંદો ખુટે છે.  
કુદરત ના ખજાનાને ખોટ પડે ત્યારે, વિધાતા પણ ધરતી ના પુષ્પોને ચુંટે છે.

લ્હાલ ના વડલા જેવું આપનું અસ્તિત્વ તો અમારી વચ્ચે નથી,  
પરંતુ એ વડલાની શીતળ છાયા સમાન આપના દ્વારા થયેલું જીવન ઘડતર અને  
સંસ્કારોનું સિંયન, સંધર્ષ પ્રત્યે સકારાતમક જીવનશૈલી અને સમતાભાવ  
અમારા માટે પથદર્શક, પ્રેરણાદાયી અને આશીર્વાદરૂપ બની રહે એ જ પ્રાર્થના

**:: પ્રેમાન પરિવાર ::**

**સ્વ. કાંતિલાલ કપુરચંદ મહેતા પરિવાર**

માતા	:- મંજુલાબેન કાંતિલાલ મહેતા
ધર્મપતિનિ	:- માથા અતેન્દ્ર મહેતા
ભાઈ-ભાલી	:- હર્ષા ભરત મહેતા / દિપા પરાગ મહેતા
બહેન-બનેવી	:- મીના હર્ષદરાય વારીયા / હર્ષા પ્રદીપકુમાર મહેતા / નયના કુમાર ઐથર
પુત્ર-પુત્રિયા	:- ઉર્વા કેજલ મહેતા / નિકિતા પારસ મહેતા
ભનીજા-ભનીજી	:- અધભ, હિરલ, દેવાંશી, હિલોની
ભાણોજ	:- વિરલ, વિશાલ, સૂરજ, વિજય, મયુર, કૃપા, રીટા, નેહા
પોત્રી-પોત્ર	:- હસ્તી, હિયાંશી

## નારી જગ્યાતિ

નાનકડી ખોલીમાં ઉદાસી પોતાની છાયા ફેલાવતી જતી હતી. કોરોનાની શરૂઆતના દિવસોમાં તો ‘મિની વેકેશન’ મળ્યું હોય એવું ગ્રાને લાગેલું. માલાના પતિ શંભુએ ખુશ થતાં કહ્યું હતું, ‘અમારી ફેક્ટરીના માલિકે કહી દીધું કે હમણાં એકાદ અઠવાડિયું તમે કોઈ કામ પર નહીં આવતા. કામ પર નથી જવાનું પણ પગાર તો મળશે હં!’

‘મને પણ બ્યુટી પાર્લર વાળાં સુખમા મેડમે આવવાની ના પાડી છે. આજે આ ૨૦૦૦ રૂપિયા આચ્ચા અને કહ્યું કે, જરૂર પડે તો બીજા પૈસા લઈ જે પણ હમણાં થોડા દિવસ પાર્લર બંધ રાખવું પડશે.’

‘ચાલો, સારું થયું. ચોમાસું આવતાં પહેલાં ઘરનાં નાનાં-મોટાં રિપેરિંગનાં કામ કરવાનાં હતાં એને માટે હવે મને ટાઈમ મળશે.’ દીકરો જરા નારાજ થઈ ગયો હતો.

‘મારે તો નોકરીનો ઇંટરવ્યૂ આપવા જવાનું હતું એ કેંસલ થઈ ગયું. હવે કોણ જાણો ક્યારે વારો આવશે?’

પણ દિવસોનાં અઠવાડિયાં થયાં ને અઠવાડિયાંના મહિના. આ કાળમુખો કોરોના ક્યારે જશે અને ક્યારે જિંદગી પૂર્વવત્ત થશે એ સવાલનો જવાબ કોઈની પાસે નહોતો. શંભુએ કેટલાય સાથીઓને ફોન કર્યા - ક્યારથી કામે ચઢવાનું છે, ખબર છે? એક વાર તો ફેક્ટરી સુધી આંટો પણ મારી આવ્યો પણ ગેટ પર મોટું તાળું જોઈને પાઇઓ ફર્યો. ભવિષ્યની ચિંતામાં એ અને મનીષ બંને સૂનમૂન થઈ ગયા હતા. એમ તો માલાને પણ ચિંતા થવા લાગી હતી પણ એટલું સારું હતું કે, એને તો એક દિવસ મેડમે ફોન કરીને બોલાવી હતી, ‘માલા, તું કાલથી આવવાનું ચાલુ કર. મારે ઓનલાઈન કલાસ ચાલુ કરવા છે એટલે

તારી મદદની જરૂર પડશે.’ ઓનલાઈન કલાસ કેવા હોય એ તો માલાને ખબર નહોતી પણ એને હંપેશાં નવું નવું જાણવાની, શીખવાની ધગશ રહેતી. એ કાયમ ધ્યાનથી મેડમને કામ કરતાં જોયા કરતી અને પછી એ પ્રમાણે કરવાની કોશિશ કરતી.

‘અરે વાહ, માલા, હવે તો તું સરસ આય બ્રોડ કરે છે અને ગ્રાહકને કરેલું મસાજ પણ બહુ પસંદ પડે છે વેરી ગૂડ.’ પ્રોત્સાહનના આવા શબ્દો જાણો એનામાં પ્રાણવાયુ પૂરતા અને એ બમણા ઉત્સાહથી કામ કરતી. ઓનલાઈન કલાસમાં મેડમ પર્સ બનાવવાનું, કાપડનાં ફૂલ બનાવવાનું, અતાર બનાવવાનું અને કેટલીય વેસ્ટ ચીજોમાંથી બેસ્ટ બનાવવાનું શીખવતાં. આ બધું શીખતી વખતે માલા કોરોનાને અને ઘરની મુશ્કેલીઓને સંદર્ભ ભૂલી જતી.

મેડમ કલાસ શરૂ કરે એ પહેલાં એ જરૂરિયાતની દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ટેબલ પર ગોઠવી દેતી. કલાસ પત્યા પછી બધી સાફ્સૂફી કરીને એ નીકળે ત્યારે મેડમ એના હાથમાં ૫૦૦ રૂપિયા મૂકતાં. પોતાની કમાણી પર ઘર ચાલે છે એ વિચારીને માલા આનંદ અનુભવતી પણ એક દિવસ એ કામ પર આવી ત્યારે એનો ચહેરો કાળોધબ્બ થઈ ગયેલો હતો.

‘શું થયું માલા? તબિયત તો સારી છે ને? જરા પણ શરદી, ઉધરસ કે તાવ જેવું લાગે તો કહેજે હં!’

જવાબ આપતાં માલા રડી પડી, ‘મેડમ શહેરમાં રહીને ખર્ચ કાઢવા ભારે પડે છે એટલે હવે અમારે ગામ જવું પડશે. મારો વર કહે છે કે, જેમ બને તેમ જલદી નીકળી જઈએ. નહીંતર અહીંયાં જ ફસાઈ જઈશું.’ પણ્ણીસ વર્ષાં

સુધી શહેરની સુખદ જિંદગી જીવા પછી હવે પાઇં ગામ જવાનું માલાને બહુ આકરું લાગતું હતું. નાનકકું, ગંદું ગામ, સંકુચિત, જુનવાણી લોકો - આ બધામાં શી રીતે રહેવાશે? સાવ નાના બેતરમાં ઉપજ કેટલી થશે? આવા વિચારો એના પગને અને મનને રોકી રવા હતા પણ એય સમજતી હતી કે ગયા વિના છૂટકો નથી. પાંચ દિવસે લાંબો પ્રવાસ પૂરો કરીને ઘરે પહોંચાં.

હવે શું કરવું એ સૌએ સાથે મળીને વિચારવાનું હતું. ગામની બધી સ્ત્રીઓ ઘરકામ આટોપીને બેતરોમાં કામ કરતી એટલે માલાને ભાગે પણ બેતરે જવાનું આવ્યું. શંખુએ બાજુમાં કરિયાણાની દુકાનવાળાને મદદ કરીને થોડી આવક ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. બાજુના શહેરમાંથી કોઈને પણ ચીજ લાવવી હોય તો એનું મહેનતાણું લઈને લાવી આપવાનું કામ મનીષે માથે લીધું.

બેતરમાં કામ કરતી બધી સ્ત્રીઓ ભેગી થઈ રોટલો ખાવા બેસ્તી ત્યારે માલા ઘણી વખત સુખમા મેડમની, બ્યુટી પાર્કરની અને ઓનલાઈન કલાસની વાતો કરતી. બધી બહેનો મુંધભાવે આ બધું સાંભળતી. એક દિવસ નવી પરણીને આવેલી સોનલે કહ્યું, ‘ભાભી, અમને પણ આવું નવું નવું શીખવોને!’

જોતજોતામાં આ વિચારભીજમાંથી મોટું વટવૃક્ષ બનશે એવી કોઈને કલ્યાના પણ કયાં હતી? ઝટઝટ કામકાજથી પરવારી સ્ત્રીઓ માલાની લાંબી પરસાળમાં ભેગી થતી. બે બહેનોને ઘરે સીવવાના સંચા હતા. યુ-ટ્યૂબ પર માસ્ક બનાવવાની રીત જોઈ પાંચ-છ બહેનોએ માસ્ક બનાવવાના શરૂ કર્યા. સોનલને મધુબની પેઈન્ટિંગ આવડતું હતું. એ માસ્ક પર પેઈન્ટિંગ કરવાના કામમાં લાગી.

‘મને અત્તર બનાવતાં તો આવડે જ છે તો એવી જ રીતે

સેનેટાઈઝર બનાવવું અધૂરું નથી.’ માલાએ કહ્યું ને થોડી બહેનોને એ કામ શીખવ્યું. ઉમરલાયક લોકો પણ હવે સેનેટાઈઝર બોટલમાં ભરવામાં મદદ કરવા માંડ્યા. મનીષે આ બધી વસ્તુઓ ઓનલાઈન વેચાણ માટે મૂકી અને અત્યંત ઉત્સહજનક પ્રતિભાવ મળવા લાગ્યો.

‘માલાભાભીએ આવીને આપણાને સૌને પોતાની કમાણી કરવાનું શીખવ્યું, આપણા કામને ગૌરવ અપાવ્યું. આપણો બધાં એમનાં આભારી છીએ.’ સોનલે ગામલોકો વચ્ચે કહ્યું ત્યારે માલાની આંખો હર્ષશ્રુથી છલકાઈ ગઈ.

મેં કદી વિચાર્યું નહોતું કે તમારા બધાનો આટલો સહકાર મળશે. હજુ તો આપણો ઘણું ઘણું કરવાનું બાકી છે. આજે હું એક નવું સૂત્ર આપું છું. બધાં મારી સાથે બોલો - ‘હમ કર સકતે હું, હમ કરકે દિખાયેંગો’ તે દિવસે એ નાનકડા ગામાં ગૂજેલા ગગનભેટી નાદથી સ્ત્રીચેતનાની લહેર ફરી વળી.

(અપણી મહાજનની મરાઈ વાર્તાને આધારે)

- આશા વીરેઝ

## Very nice poem in Gujarati

મળ્યું એ ‘માણવા’ની પણ મજા છે,  
ના મળ્યું એ ‘ચાહવા’ની પણ મજા છે !!

એકમાં એક ઉમેરો તો બે થાય  
એવું ‘શિક્ષક’ શિખવાડી ગયા, પણ  
બેમાંથી એક બાદ કરો તો એકલા થઈ જવાય  
એવું ‘જિંદગી’ શિખવાડી ગઈ!

કણિયુગની આ દુનિયાદારી છે,  
રમત રમતાં માણસ ‘ગમી’ જાય  
ને ગમતા માણસ જ ‘રમત’ રમી જાય !

ઘણા લોકો માટે હું ‘સારો’ નથી હોતો...  
પણ તમે જ કહો, ક્યો એવો દરિયો છે,  
જે ‘ખારો’ નથી હોતો...

## જીવતીય પુણ્યતિથિએ હાઇક શાલાંજલિ



જન્મ:  
તા. ૧૫-૩-૧૯૩૮

સ્વર્ગવાસ:  
તા. ૨૮-૮-૨૦૧૯



### સ્વ. શ્રી લલીતભાઈ ઓધવજી શેઠ

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હદ્યમાં  
તમારા કર્માની સુવાસ જીવંત છે અમારા શાસમાં  
સહેલ તમે નથી એ સચ્ચાઈ છે પણ તમારી યાદ  
રહેશે સદા જીવંત અમારા અસ્તિત્વમાં

આપનો પ્રેમાણ સ્વભાવ અમારા માટે આજીવન પ્રેરણાદાયક બની રહેશે  
સદ્ગતના આત્માને સ્મૃતી-પુષ્પ અર્પણા

#### પ્રેમાણ પરિવાર


ધર્મપણિ	:	જશવંતી લલીતભાઈ શેઠ
પુત્ર-પુત્રવધૂ	:	જશમીન-ઉઘ્રા - વિપુલ - જ્યોતી
પુત્રી-જમાઈ	:	માયા - હિનેશ
પૌત્ર-પૌત્રી	:	પ્રતીતી-સલોની, પલક-પ્રથમ
દોહીની	:	મનાલી-જનલ

: સૌજન્ય :

#### સિદ્ધિ એન્ટરપ્રાઇસ

૧૦૨-સ્ટીલ સેન્ટર, અમદાવાદ સ્ટ્રીટ,  
કન્સિક બંદર, મુંબઈ - ૪૦૦ ૦૦૯

Mob: JASMIN : 9821037580  
VIPUL: 9323250022  
TEL. OFF.: 23486586  
23486587



## બાળકનો માસાનુમાસિક વિકાસ

**સત્તમ માસ :** સાતમા માસમાં ગર્ભના બધા જ અંગ પ્રત્યંગ સુસ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે તથા સંપૂર્ણ બૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

**આહાર :** કીર સવિશેખ લેવી, ઓથમીર જીરાના લાડુ ખાવા, જરૂ, સાકર અને ધીલેવું. શુલકંદવાળું દેશી ગાયનું તાજુ દૂધ લેવું.

**ભક્તામર સ્તોત્ર સવાર, બપોર, સાંજ ૧-૧ વાર બોલવું.**

**સર્વાંગ માટે :** ઊંઠી અર્હ શ્રી પાર્શ્વનાથાય નમ:

**મંત્ર :** પદ્માવતી દેવીનો મંત્ર : ઊંઠી અર્હ કલીં શ્રી પદ્માવતીદેવૈ નમ:

**શ્રી ગૌતમ સ્વામિનો મંત્ર :** ઊંઠી શ્રી અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમસ્વામિને નમ:

**આચાર્ય વિજય રાજહંસસૂરિશ્વરજી**

ઊંઠી અર્હ કલીં શ્રી પદ્માવતીદેવૈ નમ:

**ભક્તામર ગાથા :** ૩૧ - સર્વત્ર સન્માન મળે છે. (being respected by every one)

**વાંચન :** તીર્થ દર્શન-ભારતભરના તીર્થોના પુસ્તકમાંથી દર્શન કરવા. દરેક તીર્થના દર્શન કરીને નમો જિષ્ણાણાં જિઅભયાણાં બોલવું. વિવિધ તીર્થો બતાવતો વિડીઓ જોવા.

**રસ :** દરેક રસ સપ્રમાણા.

**અષ્ટમ માસ :** આઠમા માસમા ગર્ભના શરીરનું ઓજ અસ્થિર હોય છે. અતઃ ક્યારેક તે માતાના શરીરમાં તો ક્યારેક બાળકના શરીરમાં રહે છે. તેથી ક્યારેક માતા પ્રસન્ન તો ગર્ભ ભ્લાન રહે છે તો ક્યારેક ગર્ભ પ્રસન્ન તો માતા ભ્લાન રહે છે. ઓજ એ આપણા શરીરનું તેજ, આભા છે. ગર્ભનું બળ આ ઓજ પર જ ટકેલું હોય છે. માટે ઓજનું રક્ષણ આ મહિનામાં ખાસ કરવું.

**આહાર :** ઓજ વર્ધક આહાર જેવાકે ધીવાળું દેશી ગાયનું તાજુ દૂધ લેવું. ઘઉંનો શીરો, પૂરણપોળી, દૂધીની ખીર, ફલ ધૂત, શતાવરી ધૂત, અશ્વગંધા ધૂત લેવું.

**કલ્યાણમંદિર સ્તોત્ર સવાર, બપોર, સાંજ ૧-૧ વાર બોલવું.**

**મંત્ર :** નાભિની નિર્વિકાર વૃદ્ધિ માટે : ઊંઠી અર્હ શ્રી શાંતિનાથાય નમ:

**ભક્તામર ગાથા :** ૨૮-બધા જ મનોરથો સિદ્ધ થાય છે. સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મી ની વૃદ્ધિ થાય છે. (fulfilling wishes & increasing fame, fortune & wealth)

**વાંચન :** નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામિ ભગવાનના જીવન ચરિત્રો વાંચવા. તેમના સત્વનો, સુતિ, થોય અને સજ્જાય વાંચવી.

**રસ :** દરેક રસ સપ્રમાણા.

**નવમ માસ :** નવમા મહિનામાં જે બાળકનો જન્મ થાય છે તે યોગ્ય ગણાય છે. તે ગર્ભસ્થ બાળક નવમા વિ. મહિનામાં જન્મે છે અને જન્મ્યા પછીની આજીવિકા ઘાવણ વિ. તે જ્યાં સુધી મેળવતો નથી ત્યાં સુધી પોતાના પૂર્વજન્મનાં કરેલાં કર્માને તથા ગર્ભવાસના સુખ દુઃખને પણ તે યાદ કરે છે. આચાર્ય ચરકાનુસાર નવ માસ થયા પછી, તેના પછીનો કોઈપણ દિવસ પ્રસવકાલ માનવામાં આવે છે. સામાન્ય રીતે નવ માસ અને ઉપર સાડા સાત દિવસને (૨૭૭)। સાડી બસ્સો સિયોતેર દિવસ) પ્રસવકાલ માનવામાં આવે છે આમાં વધ ઘટ સંભવ છે.

**નવમા, દશમા, અગ્નિયારમા કે બારમાં મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં જે ગર્ભ જન્મે છે તેને પ્રસૂતિકાલ**

કહેવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રપ્રમાણ નવ મહિના પહેલા અને બાર મહિના પછીનો કાલ વૈકારિક ગર્ભ કહેવામાં આવે છે.

ગર્ભના અંગ પ્રત્યંગ એકસાથે જ ઉત્પત્તિ થાય છે, પરંતુ જેમ કેરીના બીજમાં કેરીનું ફળ અવ્યક્ત સ્વરૂપમાં હોય છે તેમ ગર્ભના અંગ પ્રત્યંગ ઉપસ્થિત હોવા છતાં દેખાતા નથી. આમ ગર્ભશરીરમાં સર્વ અંગ પ્રત્યંગ એક સાથે ઉત્પત્તિ હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. કાલ વ્યતીત થવા પર જ્યારે વ્યક્ત થાય છે ત્યારે દેખાય છે.

**આહાર :** મેથીપાક, ઘઉંની રાબ કે ગુંડર પાક લેવા, અનુવાસન બસ્તિ લેવી. દેશી ગાયનું તાજા દૂધમાં એરંડિયું નાંખીને લેવું.

મોટી શાંતિ સવાર, બપોર, સાંજ ૧-૧ વાર બોલવું.

૧. તાલુની નિર્વિકાર વૃદ્ધિ માટે : ઊં હૌં અર્હ શ્રી ચંદ્રપ્રભુસ્વામિને નમઃ

૨. પેટની રક્ષા માટે : ઊં હૌં અર્હ શ્રી ધર્મનાથાય નમઃ

મંત્ર : ઊં હૌં અર્હ ધરણો ન્દ્રપદ્માવતી પરિપૂર્જિતાય શ્રી શાંખેશ્વર પાર્વતીનાથાય નમઃ

ઊં હૌં અર્હ શ્રી જિરાઉલી પાર્વતીનાથાય રક્ષાં કુરુ કુરુ સ્વાહા

ઊં હૌં શ્રી અર્હ નમિઉણ પાસ વિસહદ વસહ જિણા કુલ્લિંગ હૌં શ્રી અર્હ નમઃ

ભક્તામર ૧ - બધા જ વિનિધ દૂરતાય છે. (removing all types of obstacles)

૨ - બધા જ રોગ દૂર થાય છે ખાસ કરીને માથાનો દુખાવો. (curing diseases especially headaches)

**વાંચન :** શ્રમણ શ્રમણી ચરિત્ર-પ્રાચીન અર્વાચીન શ્રમણ શ્રમણીના જીવન ચરિત્રો વાંચવા અને તેના પર ચિંતન કરવું. મહાપુરુષ અને મહાસતીઓના જીવન ચરિત્ર વાંચવા. (ભરેહસરની સજ્જાયમાંથી)

**રસ :** ખારા પદાર્થ વિશેષ.

નવમા માસ પછી જન્મસમય સુધી કટુ રસ વિશેષ.

### જેન દર્શનોકત ગર્ભ સંસ્કાર

ભગવાન મહાવીરને ગર્ભમાં જ ત્રણ પ્રકારનું જ્ઞાન હતું. ભતિ, શુંત અને અવધિ. તેઓ ગર્ભમાં વિચારે છે કે મારા હલન ચલનથી માતાને કષ્ટ પહોંચે છે માટે અંગોપાંગ અનીરીતે સંકોચી રાખ્યા કે જેથી માતાને કષ્ટ ન પહોંચે. આમ આ પ્રસંગ આપણાને સૂચ્યવે છે કે ગર્ભમાં પણ બાળક વિચારી શકે છે. પ્રભુને ત્રણ જ્ઞાન હતાં, પરંતુ પ્રભુ જ્ઞાનથી નહિ મનથી વિચારે છે. સામાન્ય શિશ્યને પણ જેવું જ્ઞાન કરાવવામાં આવે તેવું તે ગ્રહણ કરે છે. આમ પ્રથમથી જ્ઞાન ન હોવા છતાં પણ નવું જ્ઞાન કે સંસ્કાર આપી શકાય અને શિશ્ય તે અવશ્યથી ગ્રહણ કરે છે. માટે જ ગર્ભમાંથી જ બાળકને માતૃભક્તિ, પ્રભુભક્તિ જેવા પાઠ આપવા.

ગર્ભમાં જ પ્રભુ મહાવીરે નિયમ લીધો કે જ્યાં સુધી મારા માતાપિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા લેવી નહીં. આમ માતાપિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચ્યવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગર્ભસ્થશિશુ ગર્ભમાં બધું જ સાંભળે છે, અનુભવ કરે છે અને બધું જ સમજે છે, પણ જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે પ્રસૂતિની વેદના તેમ જ બહારના વાતાવરણાના સંપર્કના કારણો તેને ગર્ભવસ્થા દરમિયાનનું સુખ દુઃખનું વિસ્મરણ થઈ જાય છે, પણ ગર્ભવસ્થા દરમિયાન આપેલા સંસ્કારોનું બીજારો પણ થઈ જાય છે જે નિમિત્ત મળતા વિકસિત થાય છે.

ગર્ભમાં રહેલો જીવ પોતે અંદર સુતારની પેઠે શરીરની બાર પાંસળીના કરંડક તથા છ પાંસળીઓ બનાવે છે. પીઠના અસ્થિના અઢાર સાંધાઓ તથા પાંચ વાંબ જેટલું લાંબુ આંતરદું પણ પોતે જ રચે છે. ગર્ભ આઠમે મહિને ઘણો ખરો પૂર્ણ થઈ જાય છે તે પહેલાં નવ્યાંસું લાખ રોમકૂપ તથા દાઢીના, મૂછના અને માથાના સર્વ મળી સાડા ગ્રષ કરોડ રોમ ઉત્પત્ત કરે છે. આઠમે મહિને તે ઓજ ગ્રહણ કરે છે. આ રીતે ગર્ભવાસમાં રહેલો જીવ ૨૭૭ ૧/૨ સાડી બસોસિયોતેર દિવસ વ્યતિત કરે છે. નિયમથી જીવ ૮૨૨૫ મુલ્હૂર્ત સુધી ગર્ભમાં રહે, પણ તેમાં હાનિ વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં ૩, ૧૪, ૧૦, ૨૨૫ શાસોચ્છવાસ હોય છે. તેમાં ઓછા અધિક પણ હોઈ શકે. ગર્ભ ઉત્પત્તિ યોગ્ય યોનિમાં ૧૨ મુલ્હૂર્ત સુધી લાખ પૃથ્વકૃત્વથી અધિક જીવ રહે છે. ગર્ભસ્થ જીવ બધી તરફથી આહાર કરે છે. બધી તરફથી પરિણામિત કરે છે. બધી તરફથી શાસ લે છે અને છોડે છે. નિરંતર આહાર કરે છે અને પરિણામાવે છે. જલદી શાસ લે છે અને મૂકે છે. માતાના શરીરથી જોડાયેલ પુત્રના શરીરને સ્પર્શ કરનાર એક નાડી હોય છે જે માતાના રસની ગ્રાહક અને પુત્રના જીવન રસની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર કરે છે તેવો જ પરિણામાવે છે. ગર્ભસ્થ જીવ મુખેથી આહાર કરતો નથી. તેની માતા જે વિવિધ પ્રકારની રસ વિગઈ કરું, તીખું, તુરુ, ખારું, મીહું દ્વય ખાય તેના જ આંશિક રૂપ ઓજાહાર કરે છે.

**શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે:-**

**હે ભગવંત ! શું ગર્ભમાંથી જીવ નરકે જઈ શકે ?**

ભગવાન મહાવીર તેમને ઉત્તર આપતા કહે છે કે હે ગૌતમ ! કોઈ ગર્ભમાં રહેલો સંશી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિવાળો જીવ વીર્ય વિભંગજ્ઞાન વૈક્રિય લબ્ધિ દ્વારા શત્રુસેનાને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું છું. પછી વૈક્રિય સમુદ્ધાત કરી ચતુરંગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું.

તે અર્થ, રાજ્ય, ભોગ અને કામનો આકંશી, અર્થ આદિનો ઘાસીતે જ ચિત્ત-મન-લેશ્યા અને અધ્યવસાયવાળો, અર્થાદિને વિશે તત્પર, તેને જ માટે કિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તે જ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પત્ત થાય. તેથી હે ગૌતમ એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પત્ત થાય છે, કોઈ નથી થતો.

**શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે:-**

**હે ભગવંત ! શું ગર્ભમાંથી જીવ દેવલોકમાં જઈ શકે ?**

ભગવાન મહાવીર તેમને ઉત્તર આપતા કહે છે કે ગૌતમ કોઈ ગર્ભમાં સ્થિત સંશી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિવાળો જીવ વૈક્રિય વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમપણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીખપણો સંવેગથી ઉત્પત્ત તીવ્ર ધર્માનુરૂપાંથી અનુરક્ત થાય. તે ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો કામી, ધર્માદિની આકંશવાળો પીપાસાવાળો, તેમાં જ ચિત્ત મન લેશ્યા અને અધ્યવસાયવાળો ધર્માદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ કિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ, તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પત્ત થાય છે. તેથી કોઈ જીવ દેવલોકમાં ઉત્પત્ત થાય છે, તો કોઈ નથી થતો. ગર્ભસ્થ જીવ ઉલટો સુવે છે યાવત્ માતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે છે, સભ્યકુરૂપે પરિપાલન કરે છે, વહન કરે છે, માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી હોય છે. આહાર પરિણમન અને શાસોચ્છવાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. તે મુખેથી આહાર કરતો નથી.

આના ઉપરથી સિદ્ધ થાય છે કે ગર્ભવસ્થામાં આવેલ જીવ કાનથી બધું સાંભળે છે અને સાંભળ્યા પછી વિચાર કરી શકે છે. ગર્ભવતી માતા-પિતાની જવાબદારી કેટલી મોટી છે ? એ જે કંઈ બોલે છે, સાંભળે છે, ખાય છે, પીએ છે, જુઓ છે અને વિચારે છે તેની અસર બાળક ઉપર થાય છે.

## Mother's Experience

**Full Name :** Aashi A. Mehta

**Baby Name :** Kahaan

**Email ID :** aashi.mehta1901@gmail.com

**My Experience:** Pranam everyone, Firstly and most importantly, I would like to thank, Dr. Abhaybhai and Dr. Sejalben and p.pujya Rajhanssuri m.s. from the bottom of my heart. It is only because of their guidance that I have been able to place such deep faith in garbh sanskaran. I used to try my best to follow all the things that they told, which started with doing **ashtaprakari puja daily**. I used to count all the month wise navkarwals that was given to us in the 1st councelling. I also used to take **gyan na khamasana** daily along with counting **gyan ni navkarwali and gautam swami ni navkarwali**. I used to sing **mahavir swami nu halardu** regularly. Also, I used to recite bhaktamar daily along with the reciting its gatha no. 22 for 21 times. Since **bhaktamar** is in sanskrit it helps in developing baby's vocal and language grasping power.

The thing that I believe I had most faith in was **sankalp**. Dr. Abhaybhai used to always stress on how effective sankalp is. You can have the desired child in nature and looks if you have full faith in sankalp. I had also religiously listened to the amazingly assembled music therapy folder that Dr.

Abhaybhai and Dr. Sejalben had given. It has beautiful stavans, stutis and instrumental music which helps in positive development of your baby in womb. I had followed the baby talking also. You can inculcate the values that you want in your child right from the time he is in womb by this art of **baby talking**.

In the creative department I used to do **crotio and embroidery** which Dr. Abhaybhai had told me helps in increasing baby's concentration. I had solved the **vedic** maths booklet that was provided by them, which again helps in mental development of the baby. The **chanakya niti** sessions that they provide are absolutely worth doing it. They teach sanskrit slokas in that.

I used to wake up early in the morning to watch the sunrise and recite the bhaktamar gatha. It was told to me by them that surise time was the most effective time to recite bhaktamar. Also waking up early and sleeping early in the night was a good habit inculcated in the baby right from the womb. **I had not watched tv at all** during my full pregnancy and **hardly eaten outside food**.

Once again I thank Sanskar Shakti Kendra and each and every councillor from the bottom of my heart for guiding me in following garbh sanskaran selflessly.

# શ્રીજાંજલી



## સ્વ. સોનલબેન જીતેન્દ્રભાઈ પોરા

જામ: ૨૯.૧.૧૯૫૫

સ્વર્ગાવારા: ૪.૬.૨૦૧૯

અમારા સમસ્ત પરિવારના લાડીલા સોનલ ની અહાયારી વિદાયથી  
અમો હિંગમુઢ બળી ગયા છીયે. તેનો પ્રેમાળ સ્વભાવ, સદાય હસતો  
ચહેરો, પરોપકારની ભાવના, ધાર્મિક સંસ્કાર તથા બધાને  
એકસુત્ર માં બાંધવાની કણા અમોને સદાય યાદ રહેશે.

### જીતેન્દ્ર ગીરધરલાલ પોરા

સ્વ. સમજુબેન ગીરધરલાલ જીપનભાઈ પોરા પરિવાર

**ભાઈઓ:** શશીકાંતભાઈ, ઇલેશભાઈ, પ્રદીપભાઈ, મનોજભાઈ, અંખિનભાઈ

**બાબીઓ:** સ્વ. ચંદ્રિકાબેન, જ્યોતિબેન, બીજાબેન, ભારતીબેન, ચેતનાબેન

**નાણંદ:** મંજુલાબેન નાણંદેઈ: દિપકુમાર શાહ

**બત્રીજા તથા ભાણોજ:** કેજલ - સપના, કોશલ - માનસી, અંકુર - પૂજા, બેણિક, ધર્માલ - ધરા,

દર્શન - અમી, કવિતા - જગદીપ શેઠ, પુણિતા - રાણેન શાહ, તોરલ - ઉમંગ કુવાડિયા,

પ્રણાલી - વિરાલ જાલા, નિરાલી - જીજેશ દોશી, હેતી - તૃપાર દેશમુખ, રિદ્ધિ - નિશાંત મહેતા

**બાળકો:** હેત, સૌમિલ, હિત્યી, હેતાંશી, વંશિકા, વન્યા, યશ, જશ, લુતી.

### જીપનભાઈ લક્ષ્મીચંદ પોરા પરિવાર

સ્વ. ગીરધરલાલ અમુલખભાઈ શેઠ પરિવાર

### જીતેન્દ્ર ગીરધરલાલ પોરા

૨૪૩/૨, વધેમાન, તામિલ સંગમ હોલની સામે, સાયન (ઈસ્ટ) મુંબઈ - ૪૦૦૦૨૨.

મોબાઇલ નં.: ૦૨૨-૯૭૩૦૯૮૦૯ / ૦૨૨-૨૪૦૯૮૪૭૭

KAYAMI / SEPT.

## ધૂળમાં સોનું

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ હેતો જાઉ છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જાઓ!

દીકરાએ માણું નમાવી બાપના આશીર્વાદ જીત્યા. બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગાણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી હુઃખ વેઠયું, પણ ધીરજ ન ખોઈ, શર્ઝા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ?

ધર્મપાળ કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશકરીમાં તેને ‘બાપના આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ઓટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની

લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ!

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંંયો તોય શું? તો હવે એને એવો ધંધો હેખાડું કે ઊંઘે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશો..’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દ્શબદ ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મૌઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઉતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળ જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંઘ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળાણીઓ હતી! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુક્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી કચાંક નીકળી પડી. રેતીમાં વીંટી કચાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફરીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલતનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલતનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો?’

ધર્મપાળે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના ફેશનમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણો તમને આવી ભતિ આપી? નક્કી એ કોઈ તમારો દુષ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળો છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશો?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિકપણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. ભરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી

મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે!

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નભી મૂઠો ભરી સમુક્રતાની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા હીધી, તો

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી!

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી!

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઉઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે!

ધર્મપાળે કહ્યું: ‘ફરીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે!

સુલતાન હેતથી ધર્મપાળને લેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગો તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાગો અને રૈયતનું ઝડી શીતે પાલન કરો એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઈ છું.

બોધ : જો નિતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો હુનિયા માં કોઈ ની તાકાત નથી તમને કચાંય પાછળ પાડે...

બાપ ની સેવાનું ફળ અચૂક મળો જ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી

બાળકના મન ને જાણનારી ‘માઁ’ અને.....

ભવિષ્ય જાણનારો ‘પિતા’

આ જ બે હુનિયાના ‘મહાન જ્યોતિષ’ છે બસ એમનો ‘આદર’ કરશો તો

‘ભગવાન’ પાસે તમારે કાંઈ માંગવું ના પડે.

## સ્માર્ટફોન છોડો, તે તેમને બરબાદ કરી શકે છે

પ્રિય મિત્રો,

આટલા મોટા સમાચારપત્રમાં છપાવા છતાં પણ આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહિ, તે અંગે હું ચોક્કસ કહી શકું એમ નથી. તમારામાંથી કેટલાય લોકો પોતાના ફોન-વીડિયોજ જોવામાં. વીડિયો ગેમ્સ રમવામાં, મિત્રો સાથે ચેટિંગ કરવામાં, સોશિયલ મીડિયામાં કમેન્ટ કરવામાં અથવા તો જાણીતી હસ્તીઓની ઈન્સ્ટાગ્રામ ફીડ્સ ઝોલ કરવામાં મળ્ણ હશો અને તેથી આ લેખ વાંચવાની પ્રાથમિકતા ઘણી આધી ધકેલાઈ ગઈ હશે.

તેમ છતાં જો તમને આ વાંચવાની તક મળે તો આખો લેખ વાંચજો. આ ખૂબ મહત્વનું અને તમારા જીવન માટે ઉપયોગી છે. તમે તમારી જિંદગી ફોન પર બરબાદ કરી રહ્યા છો. હા, તમે ભારતના ઇતિહાસમાં યુવા પેઢીના સભ્ય છો, જેને પ્રથમ વખત સ્માર્ટફોન અને સસ્તું ઈન્ટરનેટ વાપરવાની તક મળેલી છે અને તમે દરરોજ કેટલાય કલાકો તેની પાછળ ખર્ચી રહ્યા છો. તમારો મોબાઇલ (ડિજિટલ) સ્કીન પર ગાળેલો સમય તપાસો. યુવા લોકોમાં તે લગભગ સરેરાશ ૫-૭ કલાક હોય છે. નિવૃત્ત કે જાણીતા (પોષ્યુલર) લોકો તો ઘણાબધા કલાકો આ સાધન પાછળ આપી રહ્યાં છે. એક યુવાન વ્યક્તિ, જેને હજુ પોતાનું જીવન બનાવવાનું છે, જીવવાનું છે, તે પોતે કંઈ કરી શકતો નથી.

પાંચ કલાક, તમારા દિવસના સક્રિય કલાકોનો એક તૃતીયાંશ ભાગ છે અથવા કહીએ કે તમારા જીવનનો તૃતીયાંશ ભાગ. આજે ફોનનું વળગણ સિગારેટ્સ કે અન્ય ડ્રોસની માફક જ જિંદગીનો છિસ્સો બની ગયું છે. તે તમારી કારકિર્દિને નુકસાન પહોંચાડે છે અને મગજમાં ગડબડ કરે છે. જો આ વસ્તુ આમની આમ રહી તો, તમારી આખી જનરેશન ફરગોટન - વિસરાઈ ગયેલી જનરેશન બની જશે. આખી જનરેશનને ફોર-જીનું વ્યસન છે, જીવન જાણો ધ્યેયહીન બન્યું છે અને દેશમાં શું ચાલી રહ્યું છે તેના વિશે જાણો તેને કશો જ ઘ્યાલ નથી.

ફોનના વ્યસનની મુખ્ય ગ્રાણ નકારાત્મક અસરો:

પહેલી અસર તો અલબત્ત સમયની બરબાદી. જેનો

કદાચ જીવનમાં ઉત્પાદક કામોમાં ઉપયોગ કરી શકાય. કલ્યાના કરો કે દિવસના ગ્રાણ કલાક ફોનમાંથી બચી જાય અને તે સમયનો ઉપયોગ શરીરની તંદુરસ્તી માટે, નવી આવડત-કૌશલ્ય શીખવામાં, વધુ અભ્યાસ કરવામાં, વધારે સારી રીતે નોકરી શોધવામાં, ધંધો શરૂ કરવામાં કરી શકો છો. કલ્યાના કરો કે જો તમે નિયમિત આમ કરશો, તો તે તમને ક્યાં લઈ જશે!

બીજી અસર, તેમાં મોટાભાગો આવતી ફાલતુસામગ્રીઓ જોવાથી મગજની રચનાત્મક શક્તિઓ નબળી પડે છે. આપણા મગજના બે વિભાગ હોય છે - સમજશક્તિ અને ભાવનાત્મક. એક સ્વસ્થ મગજમાં આ બંને સારી રીતે ચાલવાં જોઈએ. જ્યારે તમે ફાલતુ-મૂર્ખતાપૂર્ણ સામગ્રી જુઓ છો, ત્યારે મગજનો સમજશક્તિનો ભાગ ઓછો વપરાય છે. ધીમે ધીમે તમે વિચારવાની શક્તિ, વિવેકબુદ્ધિ કે તર્કબદ્ધ દલીલ કરવાની આવડત ગુમાવી બેસો છો. તમે અલગ દસ્તિકોણથી જોવાનું ચૂકી જાઓ છો, કોઈ બાબત કે ઘટના પાછળનાં પરિબળો, વિચારપ્રક્રિયા દ્વારા સમજ શકતા નથી, ગુણાદોષનું મૂલ્યાંકન કરવા સજજ રહેતા નથી અથવા તો યોગ્ય નિર્ણય લઈ શકવા માટે અસર્વદ્ધ બનો છો.

તમારી સમજશક્તિ જાણો સુશ્ર થઈ ગઈ હોવાથી તમે માત્ર ભાવનાત્મક રીતે જ વિચારો છો. સોશિયલ મીડિયા પર સતત ગુસ્સો, ધ્રુવીકરણ, જાણીતી હસ્તીઓ કે રાજકારણીઓ પર તીવ્ર પ્રેમ અથવા નફરતની લાગણી, માત્ર ચીસો પાડતા કેટલાક ટીવી એકરોની લોકપ્રિયતા જોઈને એવું લાગે છે કે એક એવી પેઢી તૈયાર થઈ રહી છે જેના મગજ પર માત્ર ભાવનાનો અંકુશ છે પણ તેને તર્ક સાથે ઓછો સંબંધ છે. જે લોકો માત્ર ભાવનાત્મક રીતે કામ કરતાં હોય છે તેઓ જીવનમાં સારું કામ કરી શકતાં નથી. હવે માત્ર એક જ રસ્તો છે - તમારા મગજને નિર્ણય બનતું અટકાવો અને તમારી જાતને વધુ ને વધુ ઉત્પાદક કામોમાં જોડો.

ગીજી અસર, સતત મોબાઇલ સ્કીન પર સમય ગાળવાથી તમે પ્રેરણા (કશુંક નવું - જુદું કરવા) અને

ઉર્જ ગુમાવો છો. જીવનમાં હેતુ નક્કી કરવાથી સફળતા મળે છે, સતત પ્રેરિત રહેવાથી અને મહેનત કરવાથી નક્કી કરેલ ધ્યેયો સિદ્ધ કરી શકાય છે. જ્યારે, સ્કીન પર રહેવાથી તમે આગસુ બનો છો. ઉંડે સુધી નિષ્ફળતાના ડરને લીધે તમને ખાતરી નથી કે તમે ફરીથી કામે વળગી શકશો કે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો તમે જાણો આત્મવિશ્વાસ ગુમાવો છો. તેનો સામનો કરવા માટે, તમારે સફળતા ન મળવાનું કારણ શોધવું જોઈએ.

તમે દુશ્મન શોધવાના પ્રયત્નમાં - અત્યારના ખરાબ નેતાઓ, ભૂતકાળના ખરાબ નેતાઓ, મુસ્લિમો, બોલિવૂડનો વંશવાદ, પૈસાદાર લોકોને તમારી જિંદગી ખરાબ થવા પાછળના વિલન બનાવી રહ્યા છો. હા, વ્યવસ્થા અન્યાયી અને મુશ્કેલ છે. પણ, માત્ર સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાથી તેના અંગો સમાધાન મેળવવું શક્ય નથી. એ માત્ર ને માત્ર મહેનત કરવાથી બદલાઈ શકે છે. ફરિયાદ કરવાનું બંધ કરો. નવું સર્જન કરવાની શરૂઆત કરો. તમારા માટે એક સારું જીવન બનાવો અને એક સારા માણસ બનો. શું તમે તમારી કાર્યક્ષમતા મુજબ કામ કરો છો? તમે તમારાથી થાય એટલી મહેનત કરો છો? જ્યાં સુધી જીવનમાં કંઈક હાંસલ ન કરી લો ત્યાં સુધી આ નકામા ફોનને તમારાથી દૂર રાખો. વિજેતાઓ મુશ્કેલીઓમાંથી મારગ કાઢે છે. તમે પણ કાઢી શકો છો. નશીલા દ્રાવણથી વિપરીત ફોર-જી ફોન કાયદેસર માન્યતાપ્રાપ્ત છે. બાળકો તેને પોતાના બિસ્સામાં રાખી શકે છે. ફોન માહિતી મેળવવા. ખરીદી કરવા કે ઓનલાઈન શિક્ષણ મેળવવા ખૂબ જ ઉપયોગી છે. તેના વડે ઘણું શીખવા મળે, સાથે વિકાસ પણ થાય છે. પરંતુ તેનાથી એક યુવાન વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે અને કદાચ આખી જનરેશન પણ.

હવે યુવાઓએ વિચારવાનું છે કે તેઓ ભારતને ક્યાં લઈ જવા ઈચ્છે છે. વિચારો, જે પેઢીએ આજાદી અપાવી તેના વિશે. તેઓ કેટલા મસ્ત હતા? તેઓ ઘરની બહાર નીકળ્યા અને દેશને આજાદ કરવા લડત આપી. મંડલ કમિશન સમયનું આંદોલન કે પછી ૨૦૧૧નું અન્ના આંદોલન મને હજ યાદ છે. યુવાનોને દેશના મુદ્દાઓ અંગો ખ્યાલ હોય છે. આજે, યુવાઓ

ખરેખર પોતાને શું અસર કરે છે તેના વિશે ચિંતિત છે ખરા? કે પછી તે સનસનાટી ભરેલા, મનોરંજક અથવા મૂર્ખામી ભરેલા સમાચારો પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપવામાં જ વસ્ત છે? અત્યારે સૌથી મહત્વની બાબત અથવા આપણી પ્રાથમિકતા છે કે અર્થતંત્રને પાટે ચઢાવવું. ચીનનું અર્થતંત્ર આપણા કરતાં પાંચ ગજાં સમૃદ્ધ છે. ચીનનાં શહેરોના ફોટો ગૂગલ પર જોઈ શકો છો. આપણો ત્યાં સુધી પહોંચવા ઘણું બધું કરવું પડશે.

(નોંધ : ચીન આપણો આદર્શ ન હોઈ શકે, કે ચીન જેવું બનવું તે આપણા વિકાસની પદ્ધતિ કે દિશા ન હોય તે અંગો સત્ત્વાન રહીએ છતાં આપણી પ્રાથમિકતા શું છે તે અંગો વિચારવું અત્યંત જરૂરી છે.  
- તંત્રી)

શું તમે તે બાબતનો વિચાર કરશો? કે પછી નિર્દોષ આંતરધર્મિય યુગલની જાહેરખબર જોઈને રોષ પ્રગટ કરશો? શું તમે તમારી કારકિર્દી પર ધ્યાન આપશો કે પછી ક્યારેય અંત ન આવે તેવા ‘રાજકારણ પ્રેરિત’ હિન્દુ-મુસ્લિમના ઐતિહાસિક મુદ્દાઓ પર સમય બગાડશો? તમે તમારું જીવન સુંદર બનાવવા ઈચ્છો છો કે પછી બોલિવૂડનાં ‘કાવતરાં’ના ઉકેલ શોધવા ઈચ્છો છો?

તમે, આજના યુવા છો. તમારે સવાલોના જવાબો શોધવાના છે. કોઈ નેતા, કલાકાર, ‘જાણીતી’ હસ્તીઓ તમારા માટે કશું કરશે નહીં. તે જ વિચારો કે તમે પોતાની જાતને અને આ દેશને કઈ દિશામાં લઈ જવા ઈચ્છો છો. ભારતને ગરીબ અને માત્ર ગૌરવશાળી બનાવવાનું ધ્યેય રાખીશું? કે દેશને સમૃદ્ધ અને વિનમ્ર બનાવવાનું ધ્યેય રાખીશું? નકામા ફોનથી છુટકારો મેળવો, પોતાની જાતને ઉત્પાદક અને સર્જનાત્મક બાબતોમાં પરોવો અને પોતાના અને દેશ માટે કંઈક કરો.

ફોર-જીની માફક આ જનરેશન દેશને આગળ લઈ જાઓ. ફરગોટન જનરેશન તરીકે અંકિત ના થતા. પ્રેમ સહ,

(ચેતન ભગતનાં ‘ટાઈબ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રકાશિત લેખનો રક્ષિત શાહે કરેલ ભાવાનુવાદ)

## LIFE

પ્રભુ પાસે બેસો  
જેમ એક દીકરો  
પોતાની માં પાસે બેસો  
કોઈ માંગણી નહિ,  
ફરિયાદ નહિ,  
વાયદાઓ નહિ,  
ઈચ્છાઓ નહિ,  
અપેક્ષાઓ નહિ.  
  
પ્રભુ પાસે બેસો  
તેમને પૂછો,  
તમે ખુશ છો,  
મારુ જીવન જોઈને ?  
શું હું તમને ગમે  
તેવું જીવન જીવું છું ?  
હોશિયાર નહિ,  
સહજ બનો.  
ચતુર નહિ,  
સરળ બનો.

પ્રભુ પાસે બેસો  
દિલ ખોલીને બેસો  
પોતાના ફુર્ઝુણો  
સમાજ પાસે ભલે છુપાવો,  
પડા ભગવાન પાસે ન છુપાવો,  
જેવા છો  
તેવા જ બનીને બેસો.  
  
પ્રભુ પાસે બેસો  
રોવું આવે તો રડી લો,  
હસવું આવે તો હસી લો,  
કંઈ ના સમજથ  
તો ચૂપચાપ, છાનો-છપનો બેસો,  
પડા એક વાર  
ભગવાન પાસે બેસો.  
  
મંદિરે જઈને, તીર્થસ્થળે જઈને  
પડા ક્યાં ભગવાન પાસે  
બેસીએ છીએ ?

આપણે મંદિર અને તીર્થસ્થળે પણ  
પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી,  
ફેબા, માસા કે મિત્ર પાસે જ  
બેસીએ છીએ.

બહુ થયું હવે કોઈ નહિ, હવે.

પ્રભુ પાસે બેસો  
ખૂબ દોડયા,  
હવે જરા અમયું થોભીએ.  
ખૂબ જોયું બહાર  
હવે થોડું ભીતર ડોક્ખિયું કરીએ.  
આંગળીયું પકડી  
ક્યાં આવ્યા'તા કોઈની,  
તે ભૂલા પડવાથી હવે ડરીએ... !

મારગ ને પગલાંને  
મોજ પડી જાય એમ,  
આપણે તો આપણામાં ફરીએ!  
બસ, પ્રભુ પાસે બેસો.

- મેહુલ વોરા

## મમતા અને સમતા

મમતા એટલે માયા. મમતા ક્યારેય મરતી નથી! સંસારનો વ્યાપ વધે છે. મમતાથી રાગ-દ્રેષ થાય છે. રાગ-દ્રેષ પડા કખાયની કરવત જેવાં ધારદાર પાસાં છે. મમતાની માયાજાળમાં ફસાયેલા માનવી બહાર નીકળી શકતા નથી! મમતા ભુલભુલામણીની સીરી છે. મમતાથી મદ આવે છે. મમતાથી સ્વાર્થ જન્મે છે. મમતાથી આધિ-વાધિ અને ઉપાધિનું પૂર આવે છે, જેમાં આપણે તણાઈ જઈએ છીએ. મમતા આપણાને દુઃખોના મહાસાગરમાં તાણી જાય છે, જેમાંથી બચવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે, પડા સમતા આપણી શક્તિ અને મતિને ઉજાગર કરે છે. સમતા આપણી સહનશક્તિને મજબૂત બનાવે છે. સમતા આપણાને દુઃખોના મહાસાગરમાંથી બહાર કાઢે છે. તિર્યચોમાં અપાર અને અનહદ સમતાભાવ હોય છે. ગમે તેટલાં દુઃખો આવે, વિરહ આવે, જાનનું જોખમ આવે, પણ તેઓ ખૂબ જ શાંત અને સ્થિર બની સમતાભાવમાં રહે અને શાંતિથી ધ્યાનમાં દૂબી જાય છે. આપણે સૌએ તિર્યચો પાસેથી સમતાભાવનો ગુણ અપનાવવો જોઈએ. તિર્યચો બહુધા સમાધિભાવમાં શાંતિથી રહે છે. સમતાભાવ જ આપણાને સુખ, શાંતિ, સંપત્તિ અને સમૃદ્ધિના સ્વામી બનાવશે.

-ઓડ. મનસુખલાલ અ. પંચમીએ

## તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના



અ.સૌ. કિર્તી મયુર મહેતાના પુત્ર મહેકના તપ ઉપવાસની આરાધના કરેલ છે.



અ. સૌ. અમી અને અમીષભાઈની સુપુત્રી  
ચિ. ધૃતી અમીષ વસાએ અહ્વાઈ તપની આરાધના કરેલ છે.

અ. સૌ. ચાંદનીબેન આશીષભાઈ મહેતા ની સુપુત્રી  
ચિ. વિયોના એ અહ્વાઈ તપની આરાધના કરેલ છે.



કેતકી વૈભવ મહેતા એ અહ્વાઈ તપની આરાધના કરેલ છે.  
દેવગુરની ફૂપાથી સર્વ તપસ્વીઓ સુખસાતામાં હશો.



## વિષમ કાળની ઉપલબ્ધિઓને ગાંઢે બાંધીને રાખો

મનુષ્યનો સ્વભાવ વિસ્મરણાનો છે. ગત સમયને તે વીસરી જઈ આગળ જવામાં એટલો ઉતાવળો બનતો હોય છે કે ધણીવાર તે સાથે લાવવાની વસ્તુ પણ પાછળ મૂકીને ચાલે છે. ભવિષ્યની સ્ક્રિપ્ટ પર ડેરવાયેલી આંખ તેને દોડાવે છે. તેને હાંસિલ કરી લેવું છે, એક, પોતાની જીત, પોતાનું સાગ્રાજ્ય અને બીજું સૌથી આગળ હોવાનું ગૌરવ. આ લોબનો કોઈ અંત નથી. સિક્કંદર હોય કે લોધી, આ રાજાઓના ઈતિહાસ આપણાને ખબર જ છે. માર્ચ ૧૭, ૨૦૨૦થી જે અવસ્થામાં આપણો હતા અને પછી ધીરે ધીરે જેમ જેમ એક પછી એક બંધનો ખૂલતા ગયા, તેમ તેમ જોયું કે મનુષ્ય જેવો હતો તેવો જ ફરી પાછો દોડવા માંડ્યો છે. ભૂલી ગયો તેના બંધનો, એ સન્નાટો અને જે આટલા દિવસોમાં નહોતું કપાયું તે અંતર સરબર કરી લેવાની હાયવોય લાગી ગયો.

દરેક દિવસ, પ્રસંગ આપણામાં કંઈક ઉમેરો કરે કે આપણામાંથી કંઈક બાદ કરે તેને સમજવું આવશ્યક. સંયોજન - કોઈનેશ, પરમ્યુટેશન આવશ્યક. એમ થતું જ રહેવું જોઈએ, સ્થિરતા તો બંધિયાર જળ જેવી નુકશાનકારક. પણ દોડ એવી પણ ન હોવી જોઈએ કે સમુદ્રમાં જે અનુભવો લીધા તેને બાજુએ મૂકીને પાછા રન-વે પર દોડી પડીએ. આપણા એ હિલ્યોળાને સાવ ભૂલી જઈએ. માનવજીતને સૃતિ-વિસૃતિનું વરદાન મળ્યું છે. વિસૃતિ એક અર્થમાં વરદાનરૂપ પણ છે. પણ જે મર્યાદિત વસ્તુમાં જીવા, જે માનવતા શીખ્યા, જેટલા કાગળોને બચાવ્યા, જે પર્યાવરણના સાથી બન્યા, જે થોડોસમય ધરના કામોમાં સહકાર દર્શાવ્યો, જે સંપ્ર દર્શાવ્યો, એ બધું કરી રીતે ભૂલી શકાય! સગવડોના અતિરેક વગર પણ જીવી શકાય છે, એકાંતમાં રહી શકાય છે, શ્રધ્ઘાના આધારે હોસ્પિટલમાં કોઈ ફુંટુંબીજન વગર એકલા લીને ધરે પાછા ફર્યા બાદ સમજાય છે કે બધી જ સંપત્તિ હોવા છતાં ઓક્સિજન ન મળે અને લાયાર બની જઈ જે જેવું છે તે તેવું સ્વીકારી, એમાં સમાયોજિત થવું પડે.

માણસ સાથેના બધા સંબંધો માત્ર સ્વાર્થના નથી હોતા,

નિરંજન ભગતને સાથે લઈને જીવવામાં કેવી પ્રસન્નતા છે, લાયો તમારો હાથ, મેળવીએ  
(કહું છું હાથ લંબાવી)!  
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે -  
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે -  
શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના,  
અરે, એના વરે આવો, પરસ્પરના હદ્યનો ભાવ ભેળવીએ,  
અને બિનઆવડત સાસું-નઠાસું કેટલુંયે કામ કરતા  
આપણા આ હાથ કેળવીએ! અજાણ્યા છો? ભલે!  
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું -  
લાયો, તમારો હાથ, મેળવીએ!

-નિરંજન ભગત

હવે આ સમય હાથ લંબાવીને ચાલીએ, કોઈના સાથી, કોઈના અવાજનો હોકાર, કોઈના હદ્યની વાત બનીએ.

મુંબઈને સમુદ્ર કિનારો વરદાનરૂપે મળ્યો છે. નરીમન પોઈન્ટની પાળ પરથી એક તરફ દરિયો અને બીજી તરફ ડામરનો રસ્તો! આ બન્ને સતત માણસને જાગતા રાખે, દિવસ દરખ્યાન ઉંચી ઈમારતોનો ખખડાટ અને રાત્રે મોજાનો નાદ. આ શહેર તમને કાલની ચિંતામાં સુવા ન દે! મરણપથારી પૂર્વની ગાઢ નિદ્રા કેવી રીતે મળે? કારણ રોજેરોજ ડાયરીના પાનાં પર કોઈક તો બાકી રહેલા કામનું નામ હોય જ. ‘સંપન્ન’ એવો શબ્દ લખીને સુવાનું ન બને, ત્યારે મને સમજાય છે કે કે આ જીવવાની ધધખ નથી, આ તો માનુષી ધધખ. જેનો કારક પણ હું જ અને કારણ પણ હું જ. અસ્તિત્વના વિકાસને બદલે વસ્તુના વિકાસને પ્રાધાન્ય આપ્યું. વૃત્તિનો વિકાસ કર્યો. આ વૃત્તિથી મુક્ત થવાનું છે. જિદ એ તમારા અસ્તિત્વ અને બીજાને બન્નેને ખલાસ કરે છે. વાણીમાં મીઠાશનહીંહોયતોચાલેપણાવર્તનમાંનમણાશહોવીજોઈએ.

એમ.જી. રોડ અને એસ.વી. રોડ પરની દોડાદોડ ચાલુ થઈ ગઈ છે, ફરી પાછા માણસોના ધડ રસ્તા પર ઉત્તરી આવ્યા છે,

પોતપોતાના સ્વખોના ભાર અને મહત્વકાંક્ષા સાથે. સન્નાટાને મનુષ્યે બગાડી દીધો છે, કોઈ પણ પરિસ્થિતિ ક્યા સદા જેમની તેમ રહેતી હોય છે! મૃત્યુનો ડર પણ ઓછો થતો ચાલ્યો છે. ગયાવર્ષ અને રહેલાવર્ષનો હિસાબ માંડવાનો સમય નથી. હા, નિરાંતે બેઠેલા મનમાં ક્યારેક યાદોના થોર ઉંગ છે અને પોતે વાવેલી સિદ્ધિ પણ ક્યારેક ક્યારેક ફૂલ બનીને ઉગી આવે ત્યારે તરંગો ઉંચાઈએ ચેતે. આ બધાની વચ્ચે મહત્વ તો મનુષ્ય હોવાનું જ. મનુષ્ય હોવું, બની રહેવું અને ટકી રહેવું, જે માત્ર ને માત્ર પોતાના આત્મ-પ્રકાશથી જ શક્ય બનતું હોય છે. આત્મ-પ્રકાશ એટલે માત્ર ફિલસ્ફૂરી નહીં પણ જે અંદરનું ‘સત’ છે, જે સમજાયું છે, જેની વાત ગાંધીજી, રવીન્દ્રનાથ, કબીર અને શ્રીમદ બધાએ કરી છે. એ કોઈ એક સંપ્રદાય કે પંથની વાત નથી, એ મનુષ્યની વાત છે. મનુષ્ય બની રહેવાની વાત છે. છેલ્લા આટલા સમય પછી ફરી પાછા આપણો એવા ને એવા કેવી રીતે હોઈ શકીએ? જો હજુ પેલો ‘હું’ આમનામ હોય તો આશ્ર્ય થાય. શબ્દોની સંવેદના તો સાવ નકામી જો એ વર્તનમાં ન આવે. આપણે ભલે જીવનને રંગમંચ માનીએ પણ વર્તન અને શબ્દભેદને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય! મનુષ્યનું હોવું, થવું એટલે જ્યારે જે બોલીએ ત્યારે તેનું મૂલ્ય કરીએ. ક્યારેક એવા લોકો મળે છે જે ‘મિથ્યામિ દુકૃમ’ સંદેશ પછી પણ એટલા ઈર્ષા અને વેરથી સભર હોય છે, ત્યારે વેદના એ થાય છે કે આવા વક્તિત્વને કારણે શબ્દ અને પર્વનું મહત્વ ઘટી જાય છે.

કાળની થપાટ જે લાગી છે, સમયના પ્રવાહ પર જે પગલા અંકિત થયા છે, તેના દર્દને ભલે વિસરીને આગળ જઈએ, પણ

તેમાંથી ધડો લઈને આગળ ચાલવાનું છે. તેને પોતાની પીઠ પર લાદીને નહીં પણ તેને જે શીખવું તેને ભૂલ્યા વગર આગળ જવાનું છે.

ફિલસ્ફૂર કાંતની એક વાત છે, અહીં બહુ વિસ્તારથી ચર્ચા કરવાનો ઉપકમ નથી પરંતુ એક આધાર તરીકે એ વાતને લઈએ તો, ‘જે વસ્તુ જેવી છે તેને તેવી જ જુઓ. આપણા પૂર્વગ્રહો, માન્યતા ઉમેરીને આપણો વસ્તુને મહિન કરી દેતા હોઈએ છીએ, તેને કારણો આપણો વસ્તુને જેવી છે, તેવી પામી શકતા નથી.’ આમ પણ એક તરફ આપણી મર્યાદિત ક્ષમતા અને તેને કારણો વસ્તુને પામવાનો મર્યાદિત દૃષ્ટિકોણ અને તેમાં પાછુ આપણું ઉમેરણ. વસંત હોય કે પાનખર, એને જેમ છે તેમ જુઓ, તો પુરેપુરી પામી શકશો. આપણું સંવેદનનું વિશ્વ બહુ મર્યાદિત છે, તેમાં આપણી પોતાની શક્તિઓની પણ ઓછપ છે. આપણો હજુ ધણું ધણું કરવાનું બાકી છે ત્યારે જાતને આવા સંકુચિત વિચારોના શરણો લઇ જઈ, જાતને ક્યા છીછરી બનાવવી!

જેમ છે તેમ ચાલીએ, ચાલતાં રહીએ, વિશ્વને પોતાના બન્ને બાહુ ખોલીને આવકારીએ. ગ્રંથિની ગાંઢ છોડીએ, ‘હું’ હોવાનું અભિમાન છોડીએ, પોતાના સ્વાર્થ સિવાયના વિશાળ પ્રદેશને પામીએ, સમાજ તમારા શબ્દો અને વચ્ચનો નથી માંગાનું, તમારા વર્તનને માંગો છે.

ચાલો, હવે જાતને, કાળને છેતરવાનું છોડી દઈએ.

આપણો, આપણને આયનામાં મળીએ.

ડૉ. સેજલ શાહ



ખામેમિ સંવે જીવે,  
સંવે જીવા ખમંતુ મે  
મિત્તી મે સંવે ભૂણસુ,  
વેરં મજ્જંન ન કેણ્ણી ॥



## વેપારમાં મોટી નિષ્ફળતા બાદ ફરીથી બેઠા કેવી રીતે થવું

આવી રહેલા પરિવર્તનને સ્વીકારવાનો આ સમય છે. દિલ ખોલીને સૌથી પહેલાં તો સ્વીકારી લો. ખોટા આગ્રહ મૂકી દો. આજે મંદી છે, માન્યું, પણ એ કાયમી નથી. કાયમી કંઈ જ નથી સાહેબ, તો મંદીની શું ઔકાત સ્વીકાર, ધીરજ અને પ્રયત્નો-આટલું જો હશેને તો આ સમય સ્વસ્થતા સાથે નીકળી જશે, પરંતુ એ પહેલાં જો હાર્યા તો મર્યાં સમજજો

એકસરખા સુખના દિવસ કોઈના જાતા નથી, એથી જ શાણા સાચબીથી લેશ ફુલાતા નથી. યસ, સુખ જો કાયમી નથી તો દુઃખ ક્યાંથી હોય. વેલ, અહીં અત્યારે ભાષણ કે આશાસન આપવાનો કોઈ દીરાદો નથી. માત્ર વાસ્તવિકતા પર લાગેલી થોડી હતાશા, નિરાશા અને નકારાત્મકતાની ધૂળ ખંખેરવાનો પ્રયાસ છે. એક પછી એક મોટા વેપારીઓના આપધાતના આંકડાઓ. મોટા ભાગના વેપારીઓની બેલેન્સશીટમાં ઘટી રહેલા ટર્નઓવરનો રેશિયો અને ધંધાના નિયમોમાં મોદી સરકારનાં નવાં ધારાધોરણોનો ભય આ બધાએ આ વેપારના માહોલમાં અને વેપારીઓના મનમાં અંજપો ઉમેરવાનું કામ કર્યું છે. જોકે આવું કંઈ પહેલી વાર નથી બન્યું. આના કરતાં પણ વધારે વણસેલી પરિસ્થિતિમાંથી આપણું અર્થતંત્ર પસાર થયું છે અને એમાંથી ફરી એકવાર બેહું પણ થયું છે. અત્યારની વ્યાપારીઓની મનસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ ક્ષેત્રના અગ્રણીઓ તેમ જ વેપારમાં મોટી નુકસાની વેઠીને એમાંથી ફરી બેઠા થનારા કેટલાક લોકો સાથે વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો આગળ.

એક જ કાણમાં કરોડોની નુકસાની, કાપો તો લોહી ન નીકળે એવી હાલત હતી : જિનેશ માર્ટલિયા

મલાડમાં રહેતા જિનેશ માર્ટલિયા શેરબ્રોકિંગમાં

અગ્રણી નામ ધરાવે છે. શેરબજારમાં કલર્ક તરીકેની નોકરીથી શરૂઆત કરનારા જિનેશભાઈએ આગળ જતાં પોતાની રીતે બ્રોકિંગ કર્યું. સફળતા મળતી ગઈ અને સાહસ વધતું ગયું. છેલ્લે પોતાની ફર્મ શરૂ કરી. મોટી રકમ રોકીને બહોળો પ્રોફિટ રળવાની રફતારમાં જોકે એકવાર ખૂબ મોટી બ્રેક લાગી ગઈ. જિનેશભાઈ કહે છે, લગભગ તું વર્ષની ઉંમર હતી. ત્યાં સુધી મોટા પાયે નુકસાન શું હોય એ જોયું નહોતું. ધાર્યા મુજબ રિઝલ્ટ મળે એમ કોન્ફિડન્સ વધતો જાય. જોકે શેરબજારમાં કેટલીકવાર અનાયાસ બનેલી ઘટનાની ખૂબ ઊરી અસર પડતી હોય છે. એવું જ થયું. પૂરા વિશ્વાસ સાથે સતત જેંચી જઈ રહેલી ‘એ’ ગેડની કંપનીના શેર મેં લીધા હતા. મેં જે રકમમાં લીધા એના કરતાં ભાવ વધતા ગયા તો પણ વેચ્યા નહીં, એ આશામાં કે હજુ ભાવ ચડશે. એને બદલે એક ઘટનાને કારણો એની કિંમત કોઈની થઈ ગઈ. સમજોને કે ૧૦૦ રૂપિયાના શેરના પાંચ પૈસા પણ ન આવે. આભ ફાટી પડ્યું મારે માથે. બહારથી પૈસા લાવેલો. હવે શું કરવું? આભરુ જાય એ મંજૂર નહોતું. એ સમયે બનેલું એવું કે જેઓ સાથ આપશે એની પૂરી શર્દ્દા હતી એવા કેટલાક લોકોએ માં ફેરવી લીધું. ગાંઠની તમામ મૂડી પણ દૂબી ગઈ. પરિવારમાં કોઈને વિગતવાર વાત નહોતી કરી. કરોડો રૂપિયાનું નુકસાન હતું. ઘણાં બધાં ઈન્વેસ્ટમેન્ટ તોડીને જેટલી ચુકવાઈ એટલી રકમ ચુકવતો ગયો. જ્યાં હાથ ટૂંકા પડ્યા ત્યાં સમયની મુદત માગી. એ સિવાય કોઈ ચારો પણ નહોતો.

સ્વાનુભવ પરથી કંઈ છું છું કે એ ઘડી એવી જ હતી કે સામે અંધકાર સિવાય કંઈ ન દેખાય. થોડા મિત્રો હતા તેમનો મોરલ સપોર્ટ ન મળ્યો હોત તો ખબર

નથી મારું શું થયું હોત. લગભગ ચાર વર્ષ મને મારા પર ચડેલાં દેવાને ઉતારતા ગયા. એ નુકસાન મારામાં જોરદાર પરિવર્તન પણ લાવ્યું છે. આજે ફરી જ્યાં હતો એના કરતાં બહેતર સ્થિતિમાં આવી ગયો છું અને એવું લાગો છે જાણો એ સમય આવ્યો જ નહોતો. જોકે મારા પોતાના અનુભવ પરથી કહીશ કે પરિસ્થિતિથી ભાગવાને બદલે એનો સ્વીકાર કરીને આગળનો વિચાર કરવામાં આવે તો એમાંથી બહાર નીકળવાનું વધુ સહેલું બને છે.'

આ દુનિયામાં બધું જ પોસિબલ છે. ૭૦ વર્ષની કોંગ્રેસની સરકારની એક જ માણસ આવીને હવા કાઢી નાખે. દાયકાઓથી રાજ કરતી અનેક માટ્ટિનેશનલ કંપનીઓએ ઊભી પૂછીયીએ ભાગવું પડે. એક મોબાઈલ કંપનીએ ઘટાડેલા કોલરેટથી અન્ય. તમામ કંપનીઓના પગ તળેથી જમીન ખસકી જાય એવું પણ બને. એક વસ્તુ સમજ લો કે આ દુનિયામાં બધું જ બની શકે અને એટલે જ આવી મંદી પણ આવી શકે. તમે ધાર્યા કરતાં નફાની ગણતરીઓ ઊંધી પડી શકે છે. આજના સમયમાં વેપારીઓએ આ વાત દિલ ખુલ્લું રાખીને સ્વીકારવી પડશે.

અમિતાભ જેવા અમિતાભે દિલ ખોલવું પડ્યું હતું. એક જમાનાના સુપરસ્ટાર અમિતાભ બચ્યન યશ જાહેર પાસે સામેથી કામ માગવા ગયેલા અને મારી પાસે પૈસા નથી એવું કહેતી વખતે મારી આબરૂનું શું થશે એવું વિચારીને ઘરે જ રહ્યા હોત તો આજે તેઓ જ્યાં છે ત્યાં ન પહોંચ્યા હોત. દિલ ખોલી દો અને કહી દો કે મને નુકસાન ગયું છે. આબરૂની ચિંતા અન્યારે રહેવા દો. મારી પાસે પૈસા નથી અને આવશે ત્યારે પાઈ પાઈ ચૂકવીશ. તમારા શબ્દોમાં સત્ય હશે અને જો નિયત સાઝ હશે તો તમારી પાસે પૈસા માગનારા લોકો પણ થોડો સમય ધીરજ રાખશો. અન્યારે ધંધાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તમે ખાલી હાથે આવ્યા અને

અહીં કરિયાણાની દુકાન કરીને પણ કરોડપતિ થઈ શક્યા, પણ હવે એ જ મેથડથી કામ કરશો તો કદાચ પરિણામ ન આવે. આજે લોજિક સાથે, તર્કબદ્ધ ખાનિંગ મહત્વાનું બન્યું છે ધંધામાં. આ સ્વીકારો અને બદલાઓ.

બાંધકામ ઉદ્યોગ આજે મંદીના માહોલ ફસાયો છે. ઘણાબધા બિલડરોના પ્રોજેક્ટ વર્ષોથી બંધ છે. તેના કારણોમાં પૈસાની ખેંચ સરકારી ઓફિસોમાં ફાઈલ અટવાયેલી હોવી ગમે તે કારણો હોય તમે હાથ ઉપર હાથ ધરીને બેસસો તમારી જિંદગી પૂરી થઈ જશે. તમારી સમસ્યાઓનું નિરાકરણ તમારે જ લાવવાનું છે. સરકાર પાસે જઈ તમારી સમસ્યાની રજૂઆત કરો. મિત્રો જિંદગી ટૂંકી છે. કોઈ પણ વાતને કાલ ઉપર મુકવા કરતા આજે જ તેનું સમાધાન શોધો. તમને નાણાં ધીરનાર અને તમારા ધરાકો એનો વિશ્વાસ જીતવા માટે તેમની સાથે મિટિંગ કરી તેમના નાણાં તથા ફ્લેટનુંપાકું કમિટમેન્ટ આપો.

તમારી જાતને સમાજમાં નિષ્ણળ વ્યક્તિ ગણાવી ન હોય તો આજે જ કામ પર લાગી જાઓ. મનુષ્ય જન્મ એક વાર મળે છે. મિત્રો માટે નીતિ સાચી રાખો, સખત મહેનત કરો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો.

વેપારી જગતના બે પ્રકારના લોકો છે. શેમકુલ જેને આબરૂ જવાનો એટલો ડર છે કે પ્રાણ આપી દે છે. વધુપડતી શેમકુલનેસને પંપાળશો તો એ મોત નોતરશે અને બીજા શેમલેસ. નફ્ફટ થઈને બીજાના પૈસા દૂબાડીને પોતે લીલાલહેર કરશે. આ પ્રકારની પ્રકૃતિના લોકો જેલમાં જશે. પૈસા લેનારને એટલું જ કહીશ કે પાછા આપવાની નિયત સાથે નવેસરથી આગળ વધો. જો નુકસાન થયું છે તો મર્સિડીઝમાં ન ફરો, ફોરેનમાં હોલિડે પર ન જાઓ. નાના એન્જોયમેન્ટ જરૂર કરો. ફાઈલસ્ટારમાં ખાવા જવાને બદલે બહાર નાની રેસ્ટરોમાં સેવપૂરી ખાવા જાઓ. નાનું એન્જોયમેન્ટ

તમારા મગજને ફરીથી નવેસરથી લડવા માટે તૈયાર કરશો. તમારી નિતિ સાફ હશે અને ખરેખર પરિસ્થિતિ વિકટ હશે તો સમાજ તમને મદદ કરશે. એક વાત યાદ રાખો ગુમાવેલો પૈસો કદાચ પાછો મળશો, પણ ગુમાવેલી આબરૂ મળશો નહીં.

જેમણો કોઈને આપેલા પૈસા પાછા નથી આવી રહ્યા તેમણો શું કરવું? પહેલાં તો એમ કહીશ કે ધારો કે કોઈ પાર્ટીમાં તમારા પૈસા પાછા નથી આવ્યા અને બેન્ક કરતાં થોડા વધુ નફાની લાલચમાં તમે જે તે વ્યક્તિને પૈસા આપતા હતા એ સમયે જ તમને ખબર હતી કે એ પૈસા દૂબી શકે છે. રિસ્ક છે એ તમને પહેલાંથી જ ખબર હતી. એટલે હવે ધીરજ ધરવી ઉચ્ચિત પર્યાય છે. જે વ્યક્તિને પૈસા આવ્યા છે તે ખરેખર જેન્યુન માણસ હોય તો તે પાછો બેઠો થાય ત્યાં સુધી રાહ જુઓ. તેની લાઈફસ્ટાઇલ પર નજર રાખો. સમય આવ્યે ફરી એકવાર તેને યાદ અપાવો.

એક વસ્તુ આપણો સૌચે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે પણ રિફોર્મ થાય. પોલિસી બદલાય તો થોડો સમય ફરી પાછી ગાડી પાટે ચડતાં લાગવાનો જ છે. આ હિમંત હારવાનો નહીં, પણ ધીરજ ધરવાનો સમય છે. વર્ષાથી આગલી સરકારોએ આદરેલા ભસ્તાચારને કારણો બેન્કિંગ સેક્ટર દેવામાં દૂબતું ગયું અને આજે અનું જ આ પરિણામ છે. બેથી ત્રણ વર્ષનો સમય આપણી ઈકોનોમીને આપો એ સાતમાં આસમાન પર પહોંચશે એટલો આપણા સૌનો ગ્રોથ થશે. આના પહેલાં પણ મંદી આવી છે, નુકસાની વેઠી છે, પણ એ સમય સાથે બદલાતી બાબત છે એ વાત કોઈએ ભુલી ન જોઈએ.

એ વાત હું પણ સ્વીકારીશ કે ૪૦ વર્ષની મારી કારકીર્દમાં અર્થતંત્રમાં આ સૌથી નબળો સમય છે.

અત્યારના સમયે સરકારે થોડી સજાગતા દેખાડવાની ચોક્કસ જરૂર છે. મને ખાતરી છે કે બે કે ત્રણ પોલિસી લેવલના યોગ્ય નિર્ણય લેવાય તો ફરીથી ઈકોનોમી સ્ટેબલિટી મેળવી લેશે. સરકારે બેન્કોનું પ્રાઈવેટાઈઝેશન કરવાની દિશામાં નક્કર નિર્ણય લેવો જોઈએ અને એ માટે આ બજેટમાં ફાળવેલું ફંડ અનેક યોજનાઓમાં લગાવી રોજગારી વધારવી જોઈએ. ઓટોમોબાઈલ ક્ષેત્રે - કાર, સ્કૂટર અને કમર્શિયલ વેહિકલને સરકારી પીઠબળની જરૂર છે. અત્યારે એ ઈન્ડસ્ટ્રીને સૌથી મોટી બ્રેક લાગી છે. આ ઈન્ડસ્ટ્રીના રો મટિરિયલ સાથે લગભગ સોએક અન્ય ઈન્ડસ્ટ્રી સંકળાયલી છે. જો એને પીઠબળ અપાય તો પોલિટિચ અસર જોવા મળશે. સરકારે નાણાભીડને ઓછી કરવા લીકવીડિટી વધારવાની જરૂર છે. સાથે દરેક ક્ષેત્રના સંઘટનને બોલાવી તેમની મુશ્કેલીનો હલ કાઢવો જોઈએ.

દરેક દેશની ઈકોનોમી તથા પ્રગતિનો આધાર ત્યાંના વેપાર ધંધા ઉપર હોય છે. લોકોની ખરીદશક્તિ વધારે હશે તો ધંધા રોજગાર ચાલશે. રોજગારીની નવી તકો ઊભી કરવી પડશે. સામાન્ય જનતાને રાહત થાય તેવા પગલાં લેવાની સખત જરૂર છે. એક સર્વે મુજબ દેશના ચાર મેટ્રો સીટીમાં આશરે પંદર લાખથી વધુ ફ્લેટો ખાલી પડેલ છે. અને લાખો પ્રોજેક્ટ્સ અધૂરા પડ્યા છે. દેશની બેન્કોનો મોટા ભાગનો પૈસો આ સેક્ટર બ્લોક થઈ ગયો છે. દેશની ઈકોનોમી પાટે ચડાવી હોય તો પૈસાની તરફતા વધારી નાણાભીડને ઓછી કરવી પડશે. સરકાર અને વેપારી વર્ગ વચ્ચે કોમ્યુનિકેશન અત્યંત જરૂરી બન્યું છે. આપણો આશા રાખીએ કે ભાજપ તથા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોટી આ દિશામાં જલદીથી પગલાં લઈ દેશને પ્રગતિને માર્ગ પાછો લઈ જશે.

- ચંદ્રેશ પાટેઅ

**શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ  
મુંબઈની ભેટની રકમ નીચે લખેલ બેંકના  
ખાતામાં જમા કરશોજુ**

NAME : SHRI SORATH VISA SHRINALI JAIN SAMAJ

BANKER : BANK OF BARODA,

M. J. MARKET, MUMBAI - 400 003.

S. B. A/C NO.: 03870100000044

IFSC : BARB0BULLIO (આ કોડમાં પાંચમું કેરેક્ટર જિરો છે.)

MICR : 40012047

શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ ટ્રસ્ટની રકમ નીચે લખેલ  
બેંકના ખાતામાં જમા કરશોજુ.

NAME : SORATH VISA SHRIMALI JAIN SAMAJ TRUST

BANKER : UNION BANK OF INDIA,

PRINCESS STREET, MUMBAI - 400 002.

S. B. A/C NO.: 319102010054364

IFSC : UBIN0531910

## મલકાડ

“છેલ્લાં પચ્ચીસ વર્ષથી મારાં વાઈફની એક ફરિયાદ રહી છે કે... હું સવારે બ્રશ કર્યા પછી ટૂથપેસ્ટની કુપ બંધ નથી કરતો... ખુલ્લી જ મૂકી દઉં છું...!!

આવતા અઠવાડિયે એનો જન્મદિવસ છે એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનું મેં નક્કી કર્યું...!! એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટૂથપેસ્ટની કુપ ભૂલ્યા વગર બંધ કરતો...!! એવી આશા સાથે કે પત્નીએ મારા સુધર્યાની નોંધ લીધી હશે...!!

હું એના સિંપલ થેંકસની રાહ જોતો હતો...!! ત્યાં જ એણો રસોડામાંથી બુમ પાડી અને પૂછજું... હમણાં ચાર-પાંચ દિવસથી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા... ??

**શ્રી સોરઠ વિશા શ્રીમાળી શુભેચ્છક મિત્ર  
મંડળની ભેટ નીચે લખેલ બેંકના ખાતામાં  
જમા કરશોજુ**

SHRI SORATH VISHASHRIMALI

SHUBHECHHAK MITRA MANDAL

BANKER : BANK OF INDIA,

80 G AACTS 1446 GF 20214 Dt. 28.5.21

bullion exchange branch, Mumbai

A/C NO.: 000810100006108

IFSC CODE NO.: BKID0000008

(આપની મોકલેલી રકમની દરેક વિગત, મોકલનારનું નામ,  
સરનામું, મોબાઇલ નંબર શ્રી વિનોદભાઈ મહેતાને મોબાઇલ  
No.: 9833500508ના વોટ્સએપ ઉપર મોકલી આપવા  
વિનંતી)

## સંસ્થા સમાચાર

આપણા સમાજની ઓફિસ હવે બપોરના ૧થી ૪ સુધી  
ચાલુ રહેશે. તો સહૃદે નોંધ લેવા વિનંતી.

સમાજના જે પણ ભાઈ અથવા બહેનને કોઈપણ લેખ અથવા  
કવિતા અથવા શ્રદ્ધાજલિની વિગત મોકલવી હોય તો નીચે  
આપેલા ઈમેલ આયડી પર મોકલશો.

આપણા સર્વ સભ્યભાઈઓને નમ્ર વિનંતી કે આપ સહૃદી  
વેબ-સાઈટ માટે આપના કુટુંબના વડિલનું નામ અને  
એડ્રેસ તથા મોબાઇલ નંબર સાથે રજીસ્ટર કરો.

Website Registration માટેનો

Mobile No. 9321775805

Email : kirtimehta.kd@gmail.com

લોકડાઉન હોવાથી ડાયરેક્ટ મેલથી મોકલવું હિતકારક છે.  
આપણો સમાજનું મુખ્યત્વ વેબસાઈટ પર દરેક મહિને  
મુકવામાં આવે છે. તો વાંચકોએ તેની નોંધ લેવી.

**સપ્ટેમ્બરના આ મુખ્યપત્રની અંદર**  
**શ્રી પદેશ-સંજય-અમિયંદ જીવનભાઈ વોરા શૈક્ષણિક  
યોજના વર્ષ ૨૦૨૧-૨૨નું ફોર્મ રાખેલ છે.**  
તો સર્વ શાન્તિબંધુઓએ જેમને જરૂર હોય એ ફોર્મ  
ભરીને ઓફિસે ભરીને મોકલી આપવા વિનંતી.

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ

ભેટની યાદી

સમાજને ભેટ

૧,૧૧૧/- ચિ. મહેક મયુર મહેતાના ઉપ ઉપવાસ નિમિત્તે  
મયુર નગીનદાસ મહેતા પરિવાર તરફથી -  
કૃત્તિ ડિયામ (જ્વેલર્સ)

૫૦૦/- ગિરીશભાઈ કોરડીયા તરફથી કલ્પેશ અને  
શેતાની અણાઈ તપસ્યા નિમિત્તે સમાજને ભેટ

મુખપત્રને ભેટ

૧,૧૧૧/- ચિ. મહેક મયુર મહેતાના ઉપ ઉપવાસ નિમિત્તે  
મયુર નગીનદાસ મહેતા પરિવાર તરફથી -  
કૃત્તિ ડિયામ (જ્વેલર્સ)

ડૉ. શાંતિલાલ રતીલાલ કોરડીયા મેડિકલ  
રાહત યોજના

૧,૧૧૧/- ચિ. મહેક મયુર મહેતાના ઉપ ઉપવાસ નિમિત્તે  
મયુર નગીનદાસ મહેતા પરિવાર તરફથી -  
કૃત્તિ ડિયામ (જ્વેલર્સ)

શ્રી સોરઠ વિશા શ્રીમાળી શુભેષ્ણક મિત્ર મંડળ,  
મુંબઈમાં ભેટની યાદી

અનાજ વિતરણ

૧,૦૦,૦૦૦/- શ્રીમતી માધુરીબેન પ્રાણલાલ દોશી તરફથી  
અનાજ વિતરણ ખાતે

૫૦૦/- આશિષભાઈ વિનોદભાઈ મહેતા તરફથી  
સુપુત્રી ચિ. વિયોનાની અણાઈ તપની આરાધના  
નિમિત્તે

આર્થિક સહાય

૫૦,૦૦૦/- શ્રી તારાચંદ ધનજી ચૌરીટી ટ્રેસ્ટ તરફથી  
સ્વ. વનીતાબેન હરકિસનદાસ મહેતાના  
આત્મશ્રેયાર્થ

૧,૧૧૧/-

ચિ. મહેક મયુર મહેતાના ઉપ ઉપવાસ નિમિત્તે  
મયુર નગીનદાસ મહેતા પરિવાર તરફથી -  
કૃત્તિ ડિયામ (જ્વેલર્સ)

૫૦૦/-

આશિષભાઈ વિનોદભાઈ મહેતા તરફથી  
સુપુત્રી ચિ. વિયોનાની અણાઈ તપની આરાધના  
નિમિત્તે

શ્રી તારાચંદ ધનજી મહેતા તથીબી રાહત  
યોજનામાં મળેલ ભેટની યાદી

૧,૧૧૧/-

ચિ. મહેક મયુર મહેતાના ઉપ ઉપવાસ નિમિત્તે  
મયુર નગીનદાસ મહેતા પરિવાર તરફથી -  
કૃત્તિ ડિયામ (જ્વેલર્સ)

**સરસ માહિતી**

ઘણા લોકો એ નહીં જાણતા હોય કે ૧૫ ઓગસ્ટ અને  
૨૬ જાન્યુઆરીએ જે રાખ્યધજ કે તિરંગાને આપણે સલામી  
આપીએ છીએ એને આ બંને દિવસો પર અલગઅલગ રીતે  
ફરકાવવામાં આવે છે

૧૫ ઓગસ્ટના દિવસે રાખ્યધજને નીચેથી રસ્સી દ્વારા  
ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. પછી ત્રિરંગો ખોલીને  
ફરકાવવામાં આવે છે, જેને 'ધજારોહણ' કહેવાય છે,  
જેના માટે અંગ્રેજમાં Flag Hoisting શબ્દ વાપરવામાં  
આવે છે, જ્યારે ૨૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર  
દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે,  
જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને 'ઝંડો ફરકાવવો'  
કહીએ છીએ, જેના માટે અંગ્રેજમાં Flag unfurling શબ્દ  
વપરાય છે.

"The weak are dominated by their ego,  
the wise dominate their ego, and  
the intelligent are in a constant  
struggle against their ego."...V

## અવસાન નોંધ

શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ

શ્રીમતી વનીતાબેન હરકીશનદાસ મહેતા તે તારાચંદ ઘનજી  
મહેતાના પુત્રવધુ (ઉ. વ. ૭૮) તા. ૧૩-૮-૨૦૨૧ના  
અરિહંતશરણ પામેલા છે.

★☆☆☆

વથલી સોરઠ નિવાસી હાલ-આંકિકા અંધિનભાઈ દેવકરણ  
વસા આંકિકા મુકામે તા. ૬-૯-૨૦૨૧ના રોજ અરિહંતશરણ  
પામેલા છે.

★☆☆☆

વથલી સોરઠ નિવાસી હાલ ગોરેગામ શામજ સુંદરજી  
શાહના પુત્ર વિનાંદભાઈ શાહ (ઉ.વ. ૮૦) તે  
તા. ૨૪-૮-૨૦૨૧ના રોજ અરિહંતશરણ પામેલા છે.

★☆☆☆

સિડોદર નિવાસી હાલ મુંબઈ વિમળાબેન દુર્લભજી જાદવજી  
મહેતાના પુત્ર હર્ષદભાઈ (ઉ. વ. ૬૭) તા. ૨૩-૮-૨૦૨૧ના  
રોજ અરિહંતશરણ પામેલા છે.

★☆☆☆

માણેકવાડા નિવાસી અમરચંદ પાનાચંદ પારેખના સુપુત્ર  
ડૉ. કાન્નિલાલ અમરચંદ પારેખ તા. ૧૬-૮-૨૦૨૧ના રોજ  
અરિહંતશરણ પામેલા છે.

★☆☆☆

શ્રી નવીનચંદ્ર વસા તા. ૧૩-૮-૨૦૨૧ના રોજ  
અરિહંતશરણ પામેલા છે.

★☆☆☆

મજેવડી નિવાસી શ્રીમતી નિર્મળાબેન દલીચંદ તારાચંદ  
મહેતા તે નિશીતભાઈ, બકુલભાઈ મહેતાના માતુશ્રી ૬-૮-  
૨૦૨૧ના રોજ ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલા છે.

## ચિંતનસૌરભ

- હિતની વાત હોય તો નાના બાળક પાસેથી પણ ગ્રહણ કરીએ છીએ તો પ્રભુની વાત સાંભળવાની, સ્વીકારવાની તૈયારી કેમ નહીં?
- ધંખી માટે આકાશમાં ઊડવું એ અક્ષય સુખ છે, તેમ આત્મા માટે અહિસામાં ઊડવું એ પરમસુખ છે. અહિસા એટલે જીવોની હત્યા ન કરવી એટલું પૂરતું નથી, બલકે પ્રત્યેક જીવ માટે અપાર પ્રેમની ધારા વહે એ અહિસા છે.
- અમે મૂર્ખ જ છીએ. હજુય ઉદ્ઘતાઈથી ઘેરાયેલા છીએ. તેથી જ્ઞાની સંતોનાં આશીર્વચનથી વંચિત છીએ.
- પ્રમાણનો તાગ અવશ્ય થવો જોઈએ. એ માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું જ રહ્યું.
- જ્ઞાન મહત્વનું પરિબળ છે. વસ્તુ-પરિસ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ જ્ઞાન કિયામાં ન પરિણામે તો બધું વર્થ છે.
- તારા ગુણોથી બીજા પ્રભાવિત થાય તો તેમનું કલ્યાણ અવશ્ય થાય, પણ તારા ગુણોનો તને અહંકાર થાય તો ભવસાગરમાં રૂબવાનો ભય છે.
- અમે હવે જાગૃત થયા છીએ, અમારા દોષોથી પરિચિત થયા છીએ. ઇન્દ્રિયવાસના કદી તૃપ્ત થવાની નથી. અમારે મૂઢ્યતામાંથી બહાર નીકળી સંયમના માર્ગ પર ચાલવું છે.
- જેને જીવનમાં કોઈ સ્પૂદા જ નથી, તે ચક્કવર્તી કરતાંય સુખી છે, કારણકે તેને કાંઈ જ મેળવવાની કે સાચવવાની ઈચ્છા હોતી નથી. એ તો નિર્મળ ચિત્તનો સ્વામી છે.
- આત્મકલ્યાણના અર્થી જીવ બહુ ઓછા હોય છે. પ્રેયની પાછળ ભટકવાને બદલે શ્રેયની ભાવના સેવીએ.
- બાધ આચાર સુંદર હોય, પણ મનની ભૂમિ નિર્મળ ન હોય તો કાંઈ અર્થ ન વળે.
- સાધનાના માર્ગમાં કાણથી વ્યથિત થવાતું નથી, કારણ ત્યાં આત્માના ગુણો પ્રગટ થતા દેખાય છે.
- ભોગ ભોગવવાની આકંશા જ દુર્ગતિનું કારણ બને છે.

## સોરઠ વિશાશ્રીમાળી જૈન સમાજ ટ્રસ્ટ

### શ્રી પરેશ-સંજય-અમીચંદ જીવણભાઈ વોરા શૈક્ષણિક યોજના

શ્રી તારાચંદ ઘનજી મહેતા કાર્યાલય

૪-દેવકરણ મેન્ઝાન, બિલ્ડિંગ નંબર-૭, બીજા માળે,  
૨૪, વિઝલદાસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૨

ફોન: ૦૨૨-૨૨૦૬૯૧૭૨ વોદસએપ: ૦૯૩૨૯૭ ૭૫૮૦૫

ઈમેલ: svjainsamajmumbai2@gmail.com

ઓઝ્યુકેશન માટે સહાયની અરજી

વર્ષ - 2021/22

અરજી ની તારીખ

અરજી કર્માંક

સમાજના સહયોદારી પારિવારિક માહિતી	વાતીનું નામ		વાતીના પિતાનું નામ		અરજી					
	મોબાઇલ નંબર	1)	2)	3)	શાહેર	જીવનો	રાખ્યો	રાખ્યો	રાખ્યો	રાખ્યો
પરિવારના સભ્યોની સંખ્યા			પરિવારમાંથી કમાનાર સભ્યોની સંખ્યા							
પરિવારનો કુલ માલિક ખર્ચ જેમ કે ઘર ભાડા, મેન્ટનન્સ, લાઈટ બિલ, મેડિકલ, તથા ધરાખર્ય વિશે										
સ્કૂલ ડી નો વાર્ષિક અંદરૂત ખર્ચ			પરિવારની માસિક આવક							
સ્થાનિક સંઘમાટી તેમજ અન્ય દ્રસ્તોમાટી આવેલ સહય ની વિગત										

અધ્યક્ષ વિદ્યાર્થીઓની શાખા કોલેજની ફી ની વિગત

વિદ્યાર્થીઓનું નામ	પાદ છોયેલ ખોરણ અને ટકા %	ભરવાની ફી ની રકમ	ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું	માયનોરીટી માટી આવેલ રકમ	પોતે કેટલી ભરી	સહય ની રકમ
1)						
2)						
3)						
વિદ્યાર્થીઓના મોબાઇલ નંબર અને ઈમેલ કર્માનુસાર લખવા	1)		2)		3)	
* શાળા કોલેજ જે નામે એક સ્ટીકરેટો દરેકના ડી એસ્ટીમેટમા સ્પષ્ટપણે લખાવવું. સહયનો એક તે નામે જે લખાશે.						
અમો સહી કરનાર ઉપરોક્ત વિગત સંપર્ક પણ સાચી છે, તો ની જવાબદારી સહી અને તારીખ	માત્રાપિતાવાળીની સહી અને તારીખ		વિદ્યાર્થીની સહી અને તારીખ			

બીડાલું	ભાડા કરાર/મેન્ટનન્સ બિલ	લાઈટ બિલ	દરેકની માઈન્ટ	દરેકના ફી એસ્ટીમેટની કોપી
વિદ્યાર્થી તથા વાતીના આધાર ડાઈ	માયનોરીટીમા કરેલ અરજીની PDF			વાતીનું પેન ડાઈ
વાતી તથા દરેક વિદ્યાર્થીઓના બેંકની વિગત માટે કોસ કરેલ ચેકની કોપી કોપી.				
ખાસ નોંધ:	1) પ્રાર્થિત ભરેલી તેમજ ખોયેલ વિડાલું વાળી અરજીઓને જ પોસેસ કરવામા આવશે. અધ્યરી અરજીઓ અમાંય રહેશે. 2) પ્રાર્થિત ભરાયેલા કોપીને એ જોરોકું કોપી સાથે લાવવા વિનતી.			

આ ભાલામણ અરજાદારને ઓળખતા સમાજના બેંકિંગ વિદ્યાર્થી પાણેથી ભાલામણ લખાવવી.		
ભાલામણ: અમો અરજાદારને ..... વાર્ષ થી ઓળખાયે છીએ. તેમણી આંશિક લિખિત નો અમોને ખાલ છે. આમને આંશિક સહય કરવા ભાલામણ છે.		
બેંકિંગ વિડાલું નામ	મોબાઇલ નંબર અને ઈમેલ	સહી

કુટા સંસ્કારના નામ, તારીખ અને સહી.	અરજી સ્વીકારનારનું નામ, તારીખ અને સહી.	કોમાયુટરમા એન્ટર કરનારનું નામ, તારીખ અને સહી.
માનસ પ્રમુખ	માનસ મંત્રી	માનસ સહ-મંત્રી

શ્રી મહેશ્વરાંદી મધુરાંદાસ સાવડિયા

શ્રી મધુરાંદી નગરીનાંદાસ મહેતા

શ્રી રિકિતભાઈ નટવરલાલ માજની





## સપ્ટેમ્બર માસના મુખ્યપત્રના સૌજન્યદાતા

**શ્રી જીવણાલાલ વીરચંદ મહેતા**

**જીવનબાપા : મૂઢી ઉંચેરા માનવી**



જૈન સમાજના અંગેસર, પ્રભર દાનવીર અને સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજના રાહબર અને હિતચિંતક મુરબ્બી શ્રી જીવણાલાલ વીરચંદ મહેતા એક આદરણીય અને સન્માનનીય વ્યક્તિ હતા. જીવનબાપાના હુલામણા નામથી લોકોના દદ્યમાં તેમણે અનેરું સ્થાન મેળવ્યું હતું.

જીવનબાપાએ સોરઠ અને સૌરાષ્ટ્રના લોકો માટે અનેક કલ્યાણકારી સમાજ ઉપયોગી યોજનાઓ અમલમાં મૂકી હતી. વાડી, સમુહલગ્ન, શાળાઓ, કોમ્પ્યુનિટી હોલ તે મજ તબીબી ક્ષેત્રે તેમણે આપેલા દાનથી સમાજના બહોળા લોકોને ફાયદો થયો હતો. આકોલા, શેગાંવ, વિદર્ભ અને બીજા શહેરો અને કલકત્તાના લોકો માટે પણ તેમણે અનેક ઉપયોગી કાર્ય કર્યા હતા. અને સમાજ પરિવર્તનની દિશામાં તેમણે અંગેસર ભૂમિકાઓ બજવી હતી. તેઓ માનતા હતા કે આર્થિક ઉત્કર્ષ વગર સમાજનું પાયાનું પરિવર્તન શક્ય નથી.

જીવનબાપાનું સમગ્ર જીવન પુરુષાર્થની પ્રયંત ગાથા જેવું હતું. શૂન્યમાંથી તેમણે સર્જન કર્યું હતું. તેમણે જીવનમાં ઘણા તડકા-છાયા જોયા હતા અને અનુભવની એરણ પર તેમનું જીવન ઘડાયું હતું. ધીરજ, સહનશીલતા અને વ્યવહાર દક્ષતાથી એક પછી એક મુકામો સર કર્યા હતા. સુપુત્રોને પાયાના સંસ્કાર આપ્યા હતા. પરિશ્રમ અને મહેનત દ્વારા આગળ વધવાની તાલીમ આપી હતી. સુપુત્રોએ વેપાર ધંધાની કુનેહથી તેમના સ્વખને સાકાર બનાવ્યું છે અને પરિવારના નામને રોશન બનાવ્યું છે.

જીવનબાપાનું સમગ્ર જીવન ધૂપસળી જેવું હતું. તેમણે ચોમેર મહેક પ્રસરાવી હતી. સુખનો તેમણે પ્રભુની પ્રસાદી તરીકે અને દુઃખનો તપક્ષયો તરીકે સ્વીકાર કર્યો હતો. તેઓ સાચા અર્થમાં કર્મયોગી હતા. સુખમાં રહેવા તેઓએ તેનાથી નિર્લેખ અને નિઃસ્પૃહી રહ્યા હતા. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો તેમને મંત્ર હતો. ૮૮ વર્ષના દીર્ઘાયુધી જીવનના પાયામાં પ્રસત્ત વ્યક્તિત્વ અને આનંદની અનુભૂતિ હતી.

કોઈ જાતની મોટાઈ નહીં, કોઈ જાતનો અહંકાર નહીં, કોઈની ટીકા નહીં, નકારાત્મક વલણ નહીં. સૌ પ્રત્યે સમાન દ્રષ્ટિ આ બધા ગુણોએ તેમને મૂઢી ઉંચેરા માનવી બનાવ્યા હતા. તેમનું દિલ ખૂબ જ ઉદાર હતું. સચ્ચાઈ અને પ્રામાણિકતા તેમના જીવનમાં વણાયેલા હતા. સગા, સંબંધીઓ અને સ્નેહીઓ પ્રત્યે અપાર ચાહના હતી. તેમના પરિચયમાં જે કોઈ આવ્યું હોય તેને કદી ભૂલતા નહીં.

જીવનબાપાએ કર્તવ્યનિષ્ઠા દ્વારા ખરો ધર્મ અપનાવ્યો. તેમનું જીવન પારદર્શક હતું. ધર્મ એ જીવન જીવવાનું કલા છે. જીવનબાપાએ આ કલા હસ્તગત કરી હતી. તેઓ માનતા હતા કે જીવન જેવું છે તેવું સ્વીકારવું એ માણસને માણસ બનાવે તે મોટો ધર્મ. આ બસે વાત તેમણે પોતાના જીવન દ્વારા સાર્થક કરી હતી. સેવા અને માનવતાને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ આ મહામાનવને કદી ભૂલશે નહીં.



KIRTI DIAM  
DIAMONDS | FINE JEWELS

ADORN YOURSELF FOR THE  
BIGGEST DAY OF YOUR LIFE



GOVT APPROVED VALUERS

7/8/9, Shankar Nagar, Vallabh Baug Lane, Tilak Road Corner, Ghatkopar(E),  
Mumbai - 400077 | info@kirtidiam.com | kirtidiamindia@gmail.com | W: www.kirtidiam.com

PUBLISHED ON 20TH EVERY MONTH - RNI - 22805 / 73 - SOATH VISHSHRIMALI (Guj. Monthly)

POSTED AT KALBADEVI HEAD POST OFFICE, MUMBAI - 400 002. ON 20th & 21st OF EVERY MONTH

Printed & Published by : **Kirtiben Mayurbhai Mehta** on behalf **Shri Sorath Visa Shrimali Jain Samaj** Printed at Arihant Printing Press - Mo. : 9223430415

If Undelivered Pl. return of - **Shri Sorath Visa Shrimali Jain Samaj** 4, Devkaran Mansion, Bldg., No. 7, 2nd Flr., 24, Vithaldas Road, Mumbai-400002. Maharashtra (India)